

નવી વર્ધિત પેન્શન યોજના (NPS)
અંતર્ગત તા. ૨૪.૦૬.૨૦૨૨ના
ઠરાવની જોગવાઇઓ મુજબ
અશક્તતા અને ચાલુ નોકરીએ
અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શન
મુજબના લાભો મંજૂર કરવા અંગેની
કાર્યપદ્ધતિ નિયત કરવા બાબત

ગુજરાત સરકાર
નાણાં વિભાગ
ઠરાવ ક્રમાંક: નિયમ/૧૦૨૦૨૧/૫૬૧૪/પી(પેન્શન સેલ)
સચિવાલય, ગાંધીનગર.
તારીખ: ૨૧.૧૦.૨૦૨૨

વંચાણે લીધા:

(૧) નાણાં વિભાગનો તા. ૨૪.૦૬.૨૦૨૨નો સરખા ક્રમાંકનો ઠરાવ


ઠરાવ :

આમુખમાં વંચાણે લીધેલા નાણા વિભાગના તા. ૨૪.૦૬.૨૦૨૨ના સરખા ક્રમાંકના ઠરાવથી રાજ્ય સરકારના નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ સમાવિષ્ટ અધિકારી/કર્મચારીઓને તા. ૦૧.૦૪.૨૦૦૫ ની અસરથી ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૫૨ થી ૬૪ મુજબ અશક્તતા પેન્શન અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૧૪૮ થી ૧૫૭ ની જોગવાઇઓને સુસંગત રહીને ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ હેઠળની કુટુંબ પેન્શન યોજના, ૧૯૭૨ ના નિયમ-૮૭ થી ૮૪ અન્વયે કુટુંબ પેન્શન મુજબના લાભો આપવાનું ઠરાવવામાં આવેલ છે.

પ્રસ્તુત ઠરાવમાં નિર્દેશ કર્યા મુજબના લાભો અધિકૃત કરવા માટે (૧) તા. ૨૪.૦૬.૨૦૨૨નો ઠરાવ પ્રસિદ્ધ થયા બાદ ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શન મુજબના લાભો મંજૂર કરવાની કાર્યપદ્ધતિ, (૨) તા. ૨૪.૦૬.૨૦૨૨ના ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા કેસોમાં અશક્તતા પેન્શન મુજબના લાભો મંજૂર કરવાની કાર્યપદ્ધતિ, (૩) તા. ૨૪.૦૬.૨૦૨૨નો ઠરાવ પ્રસિદ્ધ થયા પહેલાં ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શન મુજબના લાભો મંજૂર કરવાની કાર્યપદ્ધતિ, (૪) તા. ૨૪.૦૬.૨૦૨૨નો ઠરાવ પ્રસિદ્ધ થયા પહેલાં અવસાનના કિસ્સામાં NPS હેઠળ જમા થયેલ ભંડોળ અંગે કરવાની કાર્યવાહી, (૫) નાણા વિભાગના તા. ૨૪.૦૬.૨૦૨૨ ના ઠરાવ

અન્વયે પાત્રતા ધરાવતા પરંતુ વહીવટી કારણોસર NPS ખાતા ખુલ્યા પહેલા જે અધિકારી/કર્મચારીઓનું અવસાન થયેલ છે તેવા કેસો અંગે કરવાની કાર્યપદ્ધતિ, (૬) તા. ૨૪.૦૮.૨૦૨૨ના ઠરાવ મુજબનો ખર્ચ ઉધારવા માટેના બજેટ સદરોની વિગત (૭) માર્ગદર્શક સુચનાઓ અને પેન્શન પેપર્સ, આ ઠરાવથી નક્કી કરવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,



(દિપલ હડીયલ)

નાયબ સચિવ

નાણાં વિભાગ

નક્કી રવાના:-

- માન. રાજ્યપાલના સચિવશ્રી, રાજભવન, ગાંધીનગર
- માન. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી, સ્વર્ણિમ સંકુલ, સચિવાલય, ગાંધીનગર
- માન. નાણાં મંત્રીશ્રીના અંગત સચિવશ્રી, સ્વર્ણિમ સંકુલ, સચિવાલય, ગાંધીનગર
- માન. મંત્રીશ્રીઓ / રાજ્ય કક્ષાના મંત્રીઓના અંગત સચિવશ્રીઓ
- માન. વિરોધ પક્ષના નેતાના અંગત સચિવશ્રી, ગુજરાત વિધાનસભા, સચિવાલય, ગાંધીનગર

સચિવાલયના સર્વે વિભાગો/ તમામ ખાતાના વડાઓ/ તમામ કચેરીના વડાઓ,

- સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર
- સચિવશ્રી, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર
- રજીસ્ટ્રારશ્રી, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ
- સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર
- સચિવશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર
- સચિવશ્રી, ગુજરાત મુલ્કી સેવા ટ્રીબ્યુનલ, ગાંધીનગર

તમામ કલેક્ટરશ્રીઓ, તમામ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ

એકાઉન્ટન્ટ જનરલશ્રી (એ એન્ડ ઇ) ગુજરાત રાજ્ય, અમદાવાદ/રાજકોટ

એકાઉન્ટન્ટ જનરલશ્રી (ઓડિટ-૧, ૨), અમદાવાદ/રાજકોટ

નિયામકશ્રી, હિસાબ અને તિજોરી, ગાંધીનગર

નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ, ગાંધીનગર

નિરિક્ષકશ્રી, સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી, ગાંધીનગર

સર્વે જિલ્લા સહાયક નિરિક્ષકશ્રીઓ

તમામ તિજોરી અધિકારીઓ/ તમામ પેટા તિજોરી અધિકારીઓ

પગાર અને હિસાબી અધિકારીઓ, અમદાવાદ/ગાંધીનગર/નર્મદા/વડોદરા

સ્થાનિક ઓડિટ અધિકારી, અમદાવાદ/ગાંધીનગર.
તમામ બોર્ડ/ કોર્પોરેશન/ નિગમો.
નાણા વિભાગના સર્વે અધિકારીશ્રીઓ
નાણા વિભાગની તમામ શાખાઓ
સિસ્ટમ મેનેજર, નાણા વિભાગ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવાની કાર્યવાહી માટે
સિલેક્ટ ફાઇલ પેન્શન સેલ શાખા
• પત્ર દ્વારા

૧. તા.૨૪.૦૮.૨૦૨૨નો ઠરાવ પ્રસિદ્ધ થયા બાદ ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શન મુજબના લાભો મંજૂર કરવા માટેની કાર્યપદ્ધતિ

૧.૧ ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૧૪૮ થી ૧૫૭ ની જોગવાઈઓને સુસંગત રહીને ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ હેઠળની કુટુંબ પેન્શન યોજના, ૧૯૭૨ ના નિયમ-૮૭ થી ૮૪ અન્યથે કુટુંબ પેન્શન મુજબના લાભો મંજૂર કરવા અંગેની વિચારણા કરવાની રહેશે.

૧.૨ નાણા વિભાગના તા.૨૪.૦૮.૨૦૨૨ના ઠરાવ મુજબના લાભો મેળવવા પાત્રતા ધરાવતા અધિકારી/કર્મચારીઓના અવસાનના કિસ્સામાં જે તે અધિકારી/કર્મચારીની કચેરીએ ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૧૪૮(૩)(ક) મુજબ સ્વર્ગસ્થ અધિકારી/કર્મચારીના વારસદારને જાણ કરવાની રહેશે.

૧.૩ સ્વર્ગસ્થ અધિકારી/કર્મચારીના વારસદારે નાણા વિભાગના તા.૦૩.૦૩.૨૦૦૭ના "ઠરાવ કમાંક:ડીપીપી/૨૦૦૬/ડી-૨૦૧/પી" મુજબના આ સાથે સામેલ પેન્શન પેપર્સ (ભાગ-૩)માં જરૂરી વિગતો સહિત કુટુંબ પેન્શન મુજબના લાભો માટેની અરજી કરવાની રહેશે.

૧.૪ રાજ્ય સરકાર છારા ભારત સરકારની તા.૦૫.૦૫.૨૦૦૮ની સુચનાઓ અન્યથે રાજ્ય સરકારના નવી વર્ધિત પેન્શન યોજના હસ્તકના અધિકારી/કર્મચારીઓ કે જેઓને તા.૨૪.૦૮.૨૦૨૨ના ઠરાવનો લાલ મળવાપાત્ર થાય છે તેવા અધિકારી/કર્મચારીઓના ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શન મુજબના લાભ મંજૂર કરવાના કેસમાં અવસાનની તારીખે NPS હેઠળ જમા રકમ પૈકીની સરકાર છારા જમા કરવામાં આવેલ રકમ અને તેના પર મળેલ વળતર નિયામકશી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ સરકારી સદરે પરત જમા લેવાની રહેશે.

૧.૫ ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ના નિયમ-૮(૫૦) મુજબ સત્તા ધરાવતા અધિકારી (પેન્શન મંજૂર કરનાર અધિકારી)એ કુટુંબ પેન્શન મુજબના લાભો માટેની અરજી મળ્યેથી તા.૦૩.૦૩.૨૦૦૭ના "ઠરાવ કમાંક:ડીપીપી/૨૦૦૬/ડી-૨૦૧/પી" મુજબના આ સાથે સામેલ પેન્શન પેપર્સ (ભાગ-૪) મુજબ કુટુંબ પેન્શન મંજૂર કરવાનું રહેશે.

૧.૬ ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૮૦ થી ૮૫ની જોગવાઈઓને સુસંગત રહીને નિયમ-૮૧(૧)(ખ) તેમજ તેમાં થયેલ વખતોવખતના સુધારા મુજબ ગ્રેજ્યુઇટી ચુકવવાની રહેશે.

૧.૭ નિયામકશી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ કુટુંબ પેન્શન મુજબના લાભો મંજૂર કરવા અંગેનો પેન્શન કેસ રજૂ થયેથી બનતી ત્વરાએ વધુમાં વધુ ઓક માસમાં નિકાલ કરવાનો રહેશે.

૧.૮ બિન સરકારી અનુદાનિત સંસ્થાના કર્મચારીઓના અશક્તતા પેન્શન/ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં આ સાથે સામેલ ભાગ-૫ માં પણ જરૂરી વિગતો પેન્શન પેપર્સ સાથે સામેલ રાખવાની રહેશે.

૨. તા.૨૪.૦૮.૨૦૨૨ના ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા કેસોમાં અશક્તતા પેન્શન મુજબના લાભો મંજૂર કરવાની કાર્યપદ્ધતિ

૨.૧ ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમ-પર થી ૫૪ ની જોગવાઈઓ સંતોષાતી હોય તેવા કેસોમાં અશક્તતા પેન્શન મુજબના લાભો મંજૂર કરવા અંગેની વિચારણા કરવાની રહેશે.

૨.૨ નવી વર્ધિત પેન્શન યોજના હેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓને નાણા વિભાગના તા.૨૪.૦૮.૨૦૨૨ ના ઠરાવ મુજબના અશક્તતા પેન્શન મુજબના લાભો મંજૂર કરવા ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૮(૫૦) હેઠળ સત્તા ધરાવતા અધિકારી (પેન્શન મંજૂર કરનાર અધિકારી)એ આ સાથે સામેલ પેન્શન પેપર્સ (ભાગ-૧, ભાગ-૨) તૈયાર કરી નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિંન્ટ ફંડની કચેરીને રજૂ કરવાના રહેશે.

૨.૩ અશક્તતા પેન્શન મુજબના લાભ અપાયેલ કર્મચારીને ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના પ્રકરણ-૧૩ ના નિયમ-૧૧૨ થી ૧૨૫ ની જોગવાઈઓને સુસંગત રહી તબીબી તપાસ બાદ જ પેન્શનનું મુદ્દીકૃત રૂપાંતર કરી શકાશે.

૨.૪ અશક્તતા પેન્શન મુજબના લાભ અપાયેલ કર્મચારીને ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૮૦ થી ૮૫ ની જોગવાઈઓને સુસંગત રહીને નિયમ-૮૧(૧)(ક) તેમજ તેમાં થયેલ વખતોવખતના સુધારા મુજબ ગ્રેજ્યુર્ડ્ટી ચુકવવાની રહેશે.

૨.૫ રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારની તા.૦૫.૦૫.૨૦૦૮ની સુચનાઓ અન્યથે રાજ્ય સરકારના નવી વર્ધિત પેન્શન યોજના હસ્તકના અધિકારી/કર્મચારીઓ કે જેઓને તા.૨૪.૦૮.૨૦૨૨ના ઠરાવનો લાભ મળવાપાત્ર થાય છે તેવા અધિકારી/કર્મચારીઓના ડિસ્સામાં અશક્તતા પેન્શન મુજબના લાભ મંજૂર કર્યાની તારીખે NPS હેઠળ જમા રકમ પૈકીની સરકાર દ્વારા જમા કરવામાં આવેલ રકમ અને તેના પર મળેલ વળતર નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિંન્ટ ફંડની કચેરીએ સરકારી સહેરે પરત જમા લેવાની રહેશે.

૨.૬ નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિંન્ટ ફંડની કચેરીએ અશક્તતા પેન્શન મુજબના લાભો માટે કેસ રજૂ થયેથી બનતી ત્વરાએ વધુમાં વધુ બે માસમાં નિકાલ કરવાનો રહેશે.

૩. તા.૨૪.૦૮.૨૦૨૨નો ઠરાવ પ્રસિદ્ધ થયા પહેલાં ચાલુ નોકરીએ અવસાનના ડિસ્ટ્રિક્ટ કુટુંબ પેન્શન મુજબના લાભો મંજૂર કરવાની કાર્યપદ્ધતિ

૩.૧ ચાલુ નોકરીએ અવસાનના ડિસ્ટ્રિક્ટ ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૧૪૮ થી ૧૫૭ ની જોગવાઈઓને સુસંગત રહીને ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ હેઠળની કુટુંબ પેન્શન યોજના, ૧૯૭૨ ના નિયમ-૮૭ થી ૮૪ અન્વયે કુટુંબ પેન્શન મુજબના લાભો મંજૂર કરવા અંગેની વિચારણા કરવાની રહેશે.

૩.૨ નાણા વિભાગના તા.૨૪.૦૮.૨૦૨૨ના ઠરાવ મુજબના લાભો મેળવવા પાત્રતા ધરાવતા જે અધિકારી/કર્મચારીઓના અવસાન થયેલ છે તે અધિકારી/કર્મચારીની કચેરીએ ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૧૪૮(૩)(ક) મુજબ સ્વર્ગસ્થ અધિકારી/કર્મચારીના વારસદારને જાણ કરવાની રહેશે.

૩.૩ સ્વર્ગસ્થ અધિકારી/કર્મચારીના વારસદારે નાણા વિભાગના તા.૦૩.૦૩.૨૦૦૭ના “ઠરાવ ક્રમાંક:ડીપીપી/૨૦૦૯/ડી-૨૦૧/પી” મુજબના આ સાથે સામેલ પેન્શન પેપર્સ (ભાગ-૩)માં જરૂરી વિગતો સહિત કુટુંબ પેન્શન મુજબના લાભો મેળવવા માટેની અરજી કરવાની રહેશે.

૩.૪ રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારની તા.૦૫.૦૫.૨૦૦૮ની સૂચનાઓ અન્વયે રાજ્ય સરકારના નવી વર્ધિત પેન્શન યોજના હસ્તકના અધિકારી/કર્મચારીઓ કે જેઓને તા.૨૪.૦૮.૨૦૨૨ના ઠરાવનો લાભ મળવાપાત્ર થાય છે પરંતુ ઠરાવ પ્રસિદ્ધ થયા પહેલા જેઓના ચાલુ નોકરીએ અવસાન થયેલ છે તેઓના ડિસ્ટ્રિક્ટ અવસાન વખતે NPS હેઠળ જમા રકમ પૈકીની સરકાર દ્વારા જમા કરવામાં આવેલ રકમ અને તેના પર મળેલ વળતાર નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ સરકારી સદરે પરત જમા લેવાની રહેશે જેની વિગતવાર સૂચનાઓ આ સાથે ક્રમ-૪ માં સામેલ છે.

૩.૫ ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૮(૫૦) હેઠળ સત્તા ધરાવતા અધિકારી (પેન્શન મંજૂર કરનાર અધિકારી)એ કુટુંબ પેન્શન મુજબના લાભો માટેની અરજી મળ્યેથી તા.૦૩.૦૩.૨૦૦૭ના “ઠરાવ ક્રમાંક:ડીપીપી/૨૦૦૯/ડી-૨૦૧/પી” મુજબના આ સાથે સામેલ પેન્શન પેપર્સ (ભાગ-૪) મુજબ કુટુંબ પેન્શન મંજૂર કરવાનું રહેશે.

૩.૬ ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૮૦ થી ૮૫ની જોગવાઈઓને સુસંગત રહીને નિયમ-૮૧(૧)(ખ) તેમજ તેમાં થયેલ વખતોવખતના સુધારા મુજબ ગ્રેજ્યુઇટી ચુકવવાની રહેશે પરંતુ તા.૨૪.૦૮.૨૦૨૨ નો ઠરાવ પ્રસિદ્ધ થયા પહેલા અવસાનના જે ડિસ્ટ્રિક્ટ ઓમાં નાણા વિભાગના તા.૨૪.૧૦.૨૦૧૭ ના “ઠરાવ ક્રમાંક:નપન/૨૦૦૩/જીઓઆઈ-૧૦/પી” અને તા.૩૧/૦૮/૨૦૧૮ ના “ઠરાવ ક્રમાંક:નપન/૧૦૨૦૧૧/ડી-૨૪૫/પી” મુજબ ગ્રેજ્યુઇટી ચુકવવામાં આવેલ છે તેવા કેસો પુનઃઉપેળવાના રહેશે નહીં.

૩.૭ નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ કુટુંબ પેન્શન મુજબના લાભો મંજૂર કરવા અંગેનો પેન્શન કેસ રજૂ થયેથી બનતી ત્વરાએ વધુમાં વધુ એક માસમાં નિકાલ કરવાનો રહેશે.

૪. તા.૨૪.૦૮.૨૦૨૨નો હરાવ પ્રસિદ્ધ થયા પહેલાં અવસાનના કિસ્સામાં NPS હેઠળ જમા થયેલ ભંડોળ અંગે કરવાની કાર્યવાહી:

જે મૃતક અધિકારી/કર્મચારીના પરીવારને PRAN ખાતામાં જમા રકમનું ચૂકવણું થયેલ છે અને જેમાંથી સરકારના હિસ્સાની રકમ પરત કરવાની થાય છે તેની PRAN નંબર વાઈજ વસુલાતપાત્ર રકમની યાદી નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ IFMS Home Page પર તેમજ નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીની વેબસાઇટ <http://dppf.gujarat.gov.in> પર મુકવાની રહેશે જેમાં કર્મચારીનું નામ, PRAN, PPAN, વિલાગનું નામ, કચેરીનું નામ, કુલ જમા રકમ, ચૂકવાયેલ રકમ અને સરકારી સદરે પરત લેવાપાત્ર રકમ જેવી વિગતોનો અચૂક સમાવેશ કરવાનો રહેશે. આ યાદી સંદર્ભે કોઈપણ પ્રકારની સ્પષ્ટતાની જરૂર જણાય તો નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ દર ૧૫-દિવસે આ યાદી અપડેટ કરવાની રહેશે જેમાં નવા દ્વારા આવતા કેસો ઉમેરવાના રહેશે જ્યારે નિકાલ થયેલ કેસો દર્શાવવાના રહેશે નહીં.

૪.૧ જેઓના કિસ્સામાં પૂરેપૂરુષ જમા ભંડોળ વારસદારને પરત ચૂકવવામાં આવેલ છે તેવા કેસો

૪.૧.૧ સ્વર્ગરસ્થ કર્મચારીના વારસદાર તરફથી કુટુંબ પેન્શન મુજબના લાભો માટેની અરજી મળ્યેથી સંબંધિત કચેરીના વડાએ નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીની વેબસાઇટ <http://dppf.gujarat.gov.in> પરની યાદીની ચકાસણી કરી, આવા કેસમાં સ્વર્ગરસ્થ કર્મચારીના વારસદારને ચૂકવવામાં આવેલ રકમ પૈકીની સરકાર પક્ષે પરત લેવાપાત્ર રકમ આ સાથે સામેલ ચલણા (Annexure-I) મુજબ સરકારી સદરે પરત લેવાની રહેશે.

૪.૧.૨ જે કેસમાં વારસદારને મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુઇટી ચૂકવવામાં આવી ન હોય તે કેસમાં સરકાર પક્ષે પરત લેવાપાત્ર રકમ ગ્રેજ્યુઇટીમાંથી સરખર કરવાની રહેશે.

૪.૧.૩ સ્વ.કર્મચારીના વારસદારને મળવાપાત્ર પેન્શન એરીયર્સની રકમ સામે સરકાર પક્ષે પરત લેવાપાત્ર રકમ સરખર કરવાની રહેશે.

૪.૧.૪ ઉક્ત વિકલ્પો-૪.૧.૧, ૪.૧.૨ અને ૪.૧.૩ પૈકીના એક અથવા એકથી વધુ વિકલ્પોનો ઉપયોગ કરી સરકારી હિસ્સાની રકમ પરત લઈ શકાશે.

૪.૧.૫ ઉપરના તમામ વિકલ્પો મુજબ કાર્યવાહી બાદ પણ જો સરકાર પક્ષે પરત લેવાપાત્ર રકમ બાકી રહે તો પેન્શન પર મળવાપાત્ર હંગામી વધારા (T.I.) માંથી સરખર કરવાની રહેશે.



૪.૨ જેઓના કિસમામાં ૨૦% રકમ વારસદારને ચૂકવવામાં આવેલ છે જ્યારે ૮૦% રકમ એન્યુઈટીમાં રોકવવામાં આવેલ છે તેવા કેસો

૪.૨.૧ સ્વર્ગસ્થ કર્મચારીના વારસદાર તરફથી કુટુંબ પેન્શન મુજબના લાભો માટેની અરજી મળ્યેથી સબંધિત કચેરીના વડાએ નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિંડન્ટ ફંડની કચેરીની વેબસાઇટ <http://dppf.gujarat.gov.in> પરની ચાદીની ચકાસણી કરી, આવા કેસમાં સ્વર્ગસ્થ કર્મચારીના વારસદાર પાસેથી સરકાર પક્ષે પરત લેવાપાત્ર રકમ આ સાથે સામેલ ચલણ (Annexure-I) મુજબ સરકારી સદ્દે પરત લેવાની રહેશે.

૪.૨.૨ જે કેસમાં વારસદારને મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટી ચૂકવવામાં આવી ન હોય તે કેસમાં સરકાર પક્ષે પરત લેવાપાત્ર રકમ ગ્રેજ્યુઈટીમાંથી સરખર કરવાની રહેશે.

૪.૨.૩ સ્વ.કર્મચારીના વારસદારને મળવાપાત્ર પેન્શન એરીયર્સની રકમ સામે સરકાર પક્ષે પરત લેવાપાત્ર રકમ સરખર કરવાની રહેશે.

૪.૨.૪ ઉક્ત વિકલ્પો—૪.૨.૧, ૪.૨.૨ અને ૪.૨.૩ પૈકીના એક અથવા એકથી વધુ વિકલ્પોનો ઉપયોગ કરી સરકારી હિસ્સાની રકમ પરત લઈ શકાશે.

૪.૨.૫ જે કેસમાં વારસદાર એન્યુઈટી રદ કરાવવા ઈચ્છતા હોય તેવા કેસમાં નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિંડન્ટ ફંડની કચેરીએ વારસદારની લેખિત સંમતિ મેળવી એન્યુઈટી પ્રોવાઇડર સાથે વાટાધાટો કરી ૮૦% રકમ પરત મેળવી વિકલ્પ—૪.૨.૫ મુજબની કાર્યવાહી બાદ બાકી રહેતી સરકારી હિસ્સાની રકમ સરકારી સદ્દે પરત જમા લેવાની રહેશે જ્યારે બાકીની રકમ વારસદારના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાની રહેશે.

૪.૨.૬ ઉપરના તમામ વિકલ્પો મુજબ કાર્યવાહી બાદ પણ જો સરકાર પક્ષે પરત લેવાપાત્ર રકમ બાકી રહે તો પેન્શન પર મળવાપાત્ર હંગામી વધારા (T.I.) માંથી સરખર કરવાની રહેશે.



૫. નાણા વિભાગના તા.૨૪.૦૮.૨૦૨૨ ના ઠરાવ અન્યથે પાત્રતા ધરાવતા પરંતુ વહીવટી કારણોસર NPS ખાતા ખુલ્યા પહેલા જે અધિકારી/કર્મચારીઓનું અવસાન થયેલ છે તેવા કેસો અંગે કરવાની કાર્યપદ્ધતિ

૫.૧ સંબંધિત અધિકારી/કર્મચારીની કચેરીએ ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૧૪૮(૩)(ક) મુજબ સ્વર્ગસ્થ અધિકારી/કર્મચારીના વારસદારને જાણ કરવાની રહેશે.

૫.૨ સ્વર્ગસ્થ અધિકારી/કર્મચારીના વારસદારે નાણા વિભાગના તા.૦૩.૦૩.૨૦૦૭ના “ઠરાવ કમાંક:ડીપીપી/૨૦૦૬/ડી-૨૦૧/પી” મુજબના આ સાથે સામેલ પેન્શન પેપર્સ (ભાગ-૩)માં જરૂરી વિગતો સહિત કુટુંબ પેન્શન માટેની અરજી કરવાની રહેશે.

૫.૩ ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૮(૫૦) હેઠળ સત્તા ધરાવતા અધિકારી (પેન્શન મંજૂર કરનાર અધિકારી)એ કુટુંબ પેન્શન મુજબના લાભો માટેની અરજી મળ્યેથી તા.૦૩.૦૩.૨૦૦૭ના “ઠરાવ કમાંક:ડીપીપી/૨૦૦૬/ડી-૨૦૧/પી” મુજબના આ સાથે સામેલ પેન્શન પેપર્સ (ભાગ-૪) મુજબ કુટુંબ પેન્શન મંજૂર કરવાનું રહેશે.

૫.૪ ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૮૦ થી ૮૫ ની જોગવાઈઓને સુસંગત રહીને નિયમ-૮૧(૧)(ખ) તેમજ તેમાં થયેલ વખતોવખતના સુધારા મુજબ ગ્રેજ્યુઇટી ચુકવવાની રહેશે પરંતુ તા.૨૪.૦૮.૨૦૨૨ નો ઠરાવ પ્રસિદ્ધ થયા પહેલા અવસાનના જે ડિસાઓમાં નાણા વિભાગના તા.૨૪.૧૦.૨૦૧૭ ના “ઠરાવ કમાંક:નપન/૨૦૦૩/જીઓઆઈ-૧૦/પી” અને તા.૩૧/૦૮/૨૦૧૮ ના “ઠરાવ કમાંક:નપન/૧૦૨૦૧૧/ડી-૨૪૫/પી” મુજબ ગ્રેજ્યુઇટી ચુકવવામાં આવેલ છે તેવા કેસો પુનઃઉનેળવાના રહેશે નહીં.

૫.૫ નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ કુટુંબ પેન્શન મુજબના લાભો મંજૂર કરવા અંગેનો પેન્શન કેસ રજૂ થયેથી બનતી ત્વરાએ વધુમાં વધુ ઓક માસમાં નિકાલ કરવાનો રહેશે.

નાણા વિભાગના તા.૨૧.૧૦.૨૦૨૨ના હરાવ ક્રમાંક : નપન/૧૦૨૦૨૧/૯૬૧૪/પી(પેન્શન સેલ) સાથેનું બિડાએ

૬. તા.૨૪.૦૮.૨૦૨૨ના હરાવ મુજબનો ખર્ચ ઉધારવા માટેના બજેટ સદરોની વિગત

ક્રમ	વિગત	બજેટ સદર
૧	NPS અંતર્ગત કુટુંબ પેન્શન મુજબના લાભો	માંગણી ક્રમાંક- ૧૮ ૨૦૭૧-૦૧-૧૧૭-૦૪
૨	NPS અંતર્ગત અશક્તતા પેન્શન મુજબના લાભો	માંગણી ક્રમાંક- ૧૮ ૨૦૭૧-૦૧-૧૧૭-૦૫
૩	NPS અંતર્ગત ગ્રેજ્યુઇટી	માંગણી ક્રમાંક- ૧૮ ૨૦૭૧-૦૧-૧૧૭-૦૬
૪	NPS અંતર્ગત કુટુંબ પેન્શન અને અશક્તતા પેન્શનના કેસમાં કર્મચારી ફાળાની પરત લેવાની રકમ	૮૩૪૨-૦૦-૧૧૭-૦૩

૭.

માર્ગદર્શક સુચનાઓ:

૧. આ સુચનાઓ નાણા વિભાગના તા.૨૪.૦૮.૨૦૨૨ના ઠરાવના અમલીકરણ માટે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
૨. કર્મચારીના વારસદાર છારા પ્રસ્તુત લાભો મેળવવા માટે રજુ થતા કેસો નાણા વિભાગના તા.૨૪.૦૮.૨૦૨૨ના ઠરાવની જોગવાઈઓને સુસંગત છે કે કેમ તેની ચકાસણી સંબંધિત કચેરીના વડાએ અને નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ કરી લેવાની રહેશે.
૩. તા.૨૪.૦૮.૨૦૨૨નો ઠરાવ પ્રસિદ્ધ થયા પહેલાં અવસાન પામેલા અને તા.૨૪.૦૮.૨૦૨૨ના ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા કુટુંબ પેન્શનના કેસોના નિકાલ માટે તમામ વિભાગોએ નાયબ સચિવશ્રીથી નીચેના ન હોથ તેવા અધિકારીને, ખાતાના વડાઓની કચેરીએ નાયબ નિયામકશ્રીથી નીચેના ન હોથ તેવા અધિકારીને અને જિલ્લા કલેક્ટરશ્રીઓએ નિવાસી અધિક કલેક્ટરશ્રીને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવાના રહેશે. નોડલ અધિકારીશ્રીઓએ આ સુચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે રીતે પેન્શન કેસોનો નિકાલ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે અને તે અંગેનો રીપોર્ટ દર પંદર દિવસે સંબંધિત વહીવટી વિભાગને મોકલી આપવાનો રહેશે. સંબંધિત વહીવટી વિભાગે સંકલિત રીપોર્ટ તૈયાર કરી પેન્શન સેલ/નાણા વિભાગને મોકલી આપવાનો રહેશે.
૪. નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ તા.૨૪.૦૮.૨૦૨૨ના અમલીકરણ માટે પ્રસિદ્ધ થતી આ સુચના અન્વયેની હિસાબી પદ્ધતિ નિયત કરી કચેરીની વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે તેમજ તમામ કચેરીઓને તેની જાણ કરવાની રહેશે.
૫. તા.૨૪.૦૮.૨૦૨૨ અને આ ઠરાવ સાથેની સુચનાઓના અર્થધટનની આખરી સત્તા નાણા વિભાગમાં નિહિત રહેશે.

રજી. પો. એ. ડી.

કૃષ્ણ

પત્ર નં.

મોકલનાર કચેરીનું નામ/સરનામું

ડી. પી. પી.

કચેરીના ઉપયોગ માટે માસ્ટરકોડ નં.

--	--	--	--	--	--

.....

પીન કોડ :

--	--	--	--	--	--

તારીખ :

પત્ર,

નિયામકશ્રી,

પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકશ્રીની કચેરી,

'વીમા' અને 'વેન્ના' ભવન,

બ્લોક નં. ૧૮, ડૉ. જીવરાજ મહેતા ભવન,

ગાંધીનગર - ૩૮૨૦૧૦.

વિષય : નાણાં વિભાગના તા: ૨૪-૦૮-૨૦૨૨ ના ઠરાવ ક્રમાંક: નપન/૧૦૨૦૨૧/૬૮૧૪/પી (પેન્શન સેલ) મુજબ શ્રી / શ્રીમતી/

સંદર્ભ :: (૧) નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક : નપન-૨૦૦૩-જીઓઓાઈ-૧૦-પી, તા: ૧૮-૦૩-૨૦૦૫

(૨) નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક : નપન/૧૦૨૦૨૧/૬૮૧૪/પી (પેન્શન સેલ) તા: ૨૪-૦૮-૨૦૨૨

મહાથ્ય,

ઉપરોક્ત વિષયે આ સાથે શ્રી/શ્રીમતી/ સ્વ. કે જેઓ

તા.: ના રોજ અશક્ત નિવૃત થયેલ/ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલ છે, તેમની નિયમાનુસાર માહિતી મેળવી પેન્શન પેપર્સ ભાગ-૧ કર્મચારીની વિગતો ભાગ-૨ કચેરી સ્નરની વિગતો ભાગ-૩ તથા ભાગ-૪ અવસાન કેસ માટે કચેરી સ્નરની વિગત. ભાગ-૫ ગ્રાન્ટ ઈન એટાડ સંસ્થાના કર્મચારી માટે તૈયાર કરી, (લાગુ ન પડતું છેકી નાંખવું) પેન્શન મંજૂર કરી સેવાપોથી સાથે મોકલેલ છે. તેઓને મળવાપાત્ર પેન્શન/કુટુંબ પેન્શન/મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુએટી/પેન્શનનું મૂડીકૃત રૂપાંતર વગેરે રકમો અંગે તિજોરી અધિકારીશ્રીને આપવાપાત્ર થતી અધિકૃતિઓ આપવા વિનંતી છે.

અશક્તતા નિવૃત/ચાલુ નોકરી અવસાન થનાર કર્મચારીનો દરજણો (લાગુ પડતું ટીક કરવું)

(૧)	સરકારી રાજ્યપત્રિત	_____	(૪)	જિલ્લા પંચાયત કર્મચારી	_____
(૨)	સરકારી બીન રાજ્યપત્રિત	_____			
(૩)	વર્કચાર્જ કર્મચારી	_____	(૫)	પેન્શનપાત્ર ગ્રાન્ટ ઈન એટાડ સંસ્થાના કર્મચારી	_____

આ ફોર્મમાં દર્શાવેલ વિગતો આથી પ્રમાણિત કરવામાં આવે છે.

સ્થળ :

તારીખ :

સહી

પેન્શન મંજૂર કરનાર અધિકારી

નામ :

હોદ્દો :

પેન્શન કેસ

ભાગ-૧

નાણા વિભાગના તા: ૨૪-૦૮-૨૦૨૨ ના ફરાવ ક્રમાંક: નાય/૧૦૨૦૨૧/૬૮૯૪/પી (પેન્શન સેલ) ના ફરાવ મુજબ અશક્ત નિવૃત થયેલ કર્મચારીને નિવૃત્તિના વાબો મેળવવા માટે આપવાનું અરજ ફોર્મ

પ્રતિ,

હું શ્રી/શ્રીમતી/કુ..... હોદ્દો :

તા. : ના રોજ અશક્તતા નિવૃત થયેલ છું. મારી પેન્શન મંજૂરી અથે નીચે મુજબની માહિતી રજૂ કરું છું.

૧ સરકારી કર્મચારીનું નામ : અટક નામ પિતા/પતિનું નામ

(સેવાપોથીમાં નોંધા પ્રમાણે, જો સુધારેલ હોય તો ગેઝેટનો આધાર રાખવો)

૨ હોદ્દો :

લાણુ પડતું પગાર ધોરણ :

૩ કચેરીનું નામ સરનામું
(પીનકોડ અને ટેલિફોન નંબર સહિત) :

પીનકોડ :

--	--	--	--	--	--

ફોન નંબર :

દિવસ માસ વર્ષ

૪ જન્મ તારીખ :

૫ નોકરીમાં દાખલ તારીખ :

--	--	--	--	--	--

--	--	--	--	--	--

૬ અશક્તતા નિવૃત્તિ તારીખ :

--	--	--	--	--	--

--	--	--	--	--	--

૭ મારા યોગ્ય રીતે શાખ કરાવેલ / પ્રમાણિત કરાવેલ નીચેના દસ્તાવેજોની ત્રણ નકલ સામેલ છે. :-

(૧) સહીના ત્રણ નમુના

(૨) પતિ-પત્નીના પાસપોર્ટ કદના ત્રણ સંયુક્ત ફોટોગ્રાફ્સ

(૩) ઊંચાઈ - અંગત ઓળખચિન્હ

૮ નિવૃત્તિબાદનાં પત્રવ્યવહારનું સરનામું :

પીનકોડ :

--	--	--	--	--	--

ફોન નંબર :

ઈ-મેલ :

૯ આધાર કર્ડ નંબર :

--	--	--	--	--	--	--	--	--	--	--	--

કચેરીનું સીબ

કર્મચારીની સહી

૧૦. જે જિલ્લા/પેટા નિજોરીએથી પેન્શન મેળવવા માંગતા હોય તેનું નામ :
જિલ્લા નિજોરી પેટા નિજોરી.....
૧૧. હું મારા મળવાપાત્ર પેન્શનના ટકા (મહત્તમ ૪૦ ટકા / ન્યાયિક સેવાના અધિકારી માટે ૫૦ ટકા) ભાગનું મૂડીકૃત રૂપાંતર કરી રૂપાંતરની કિંમત આપવા આજ તા. : ના રોજ વિનંતી કરું છું.
- નોંધ : પેન્શનના રૂપાંતર માટેની અરજી મેડીકલ બોર્ડના પ્રમાણપત્ર સાથે GCSR(પેન્શન)નમુનો-૧૬ માં અરજી તેમજ નમુના ૧૮ માં મેડીકલ બોર્ડનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.
૧૨. કુટુંબની વિગતો નાણા વિભાગના તા. ૨૪/૦૮/૨૦૨૨ના ઠરાવ અન્વે ગુમુસેવા (પેન્શન) નિયમો-૨૦૦૨ ના નિયમ-૮૮ મુજબ વિગતો દર્શાવવી તા. ના દિવસે મારા કુટુંબના સભ્યોની વિગતો નીચે પ્રમાણે છે, :-

ક્રમ	કુટુંબના સભ્યોના નામ (હ્યાત માતા-પિતા સહિત)	જન્મ તારીખ	કર્મચારી/અધિકારી સાથે સંબંધ	વૈવાહિક દરજાઓ	નોંધ
૧	૨	૩	૪	૫	૬
૧					
૨					
૩					
૪					
૫					

હું બાંધેધીપૂર્વક જાહેર કરું છું, કે મારા કુટુંબની વિગતો આજની તારીખે ઉપર મુજબ છે. તેમાં કોઈપણ ફેરફાર થશે તો કચેરીના / ખાતાના વડાને તેની જાપ કરીશ.

૧.૩.

(૧) સરકારશીના નાણા વિભાગના તા. ૨૩/૦૬/૨૦૦૦ ના ઠરાવ ક્રમાંક ડીપીપી/૧૦૮૮/૪૮૬/૬૪૫(૪) પી મુજબ નિયત નમૂનામાં વારસ નિયુક્તિની ફોર્મની બે પ્રમાણિત નકલાં આ સાથે સામેલ રાખ્યું છું.

(૨) જો નિયુક્ત સગીર હોય તો

(ક) જન્મ તારીખ :

--	--	--

(ખ) સગીર વય દરમયાન સદરહુ કુમ જે વ્યક્તિને

વાલી તરફિ આપવાની હોય તેનું નામ :

--	--

સરનામું :

(પીનકેડ સહિત)

(ગ) વાલી તરફિ નિયુક્તિનો પેન્શનર સાથેનો સંબંધ :

૧૪. મારા પુત્ર/પુત્રી શ્રી/કુમારી અંધ/દિવ્યાંગ/મંદબુધિ/જન્મથી જ મૂક્-બધિર છે તેને લગતું સિવિલ સર્જનનું દાક્તરી પ્રમાણપત્રની બે નકલાં સામેલ રાખેલ છે. તેઓ જીવન નિર્ધાર પૂરતું કમાવા માટે અશક્તિમાન છે. તેમને કુટુંબ પેન્શન ચુકવવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તારે તેમના વાલી તરફિશી/શ્રીમતી ને ફરજ બજાવવા નિમું છું. શારીરિક-માનસિક દિવ્યાંગ સંતાનોના નામ દાખલ કરવા બાબતે આ સાથે સામેલ મુદ્દાનાં-૧૪ની સુચનાઓ મુજબ કાર્યવાહી કરવી (નાણા વિભાગના તા. ૨૪/૦૮/૨૦૨૨ના ઠરાવ અન્વે ગુમુસેવા (પેન્શન) નિયમો-૨૦૦૨ ના નિયમ-૮૮ મુજબ વિગતો દર્શાવવી)

૧૫. ઉપર જણાવેલ વિગતોમાં ફેરફાર કે સુધારા વધારા થાય તેવા પ્રસંગે પેન્શન અને પ્રોવિન્ટ ફૂડ નિયમકશી/કચેરીના વડા તેમજ સંબંધકર્તાને જાણ કરી અધિતન રાખવાની બાંધેધી આપ્યું છું.

ઉપરની વિગતો મારી કચેરીના વડા સમક્ષ આજ તા. ના રોજ ઉપસ્થિત થઈ પેન્શનની કાર્યવાહી અર્થે આપ્યું છું.

(કર્મચારીની માંદગી પ્રસંગે કે બહાર ગામ ગયા હોય તેવા પ્રસંગે પ્રતિનિધિ અથવા ટપાલ મારક્ષતે ઉપરની વિગતો મોકલી આપી શકાશે.)

સ્થળ :

તારીખ :

કચેરીના વડાની સહી :

નામ :

છોદ્દો :

કર્મચારીની સહી :

નામ :

છોદ્દો :

નાણા વિભાગના તા.૨૧.૧૦.૨૦૨૨ના ઠરાવ ક્રમાંક : નયન/૧૦૨૦૨૧/૬૮૧૪/પી(પેન્શન સેલ) સાથેનું બિડાણ

૧૬. બાંહેથરીપત્ર (ગુમુસેવા (પેન્શન) નિયમો-૨૦૦૨ ના નિયમ-૧૩૪/૧૩૪એ/૧૩૫)

ગુમુસેવા (પેન્શન) નિયમોના નિયમ ૧૩૪/૧૩૪ એ/૧૩૫ની વિગતો મેં વાયેલ છે અને હું તે બરોબર સમજ્યો છું અને ત્યારબાદ આથી હું બાંહેથરી ખત આપું છું કે, હું તા.: ના
રોજ અશક્તના નિવૃત થયેલ છું. તે પછીથી મારી પાસેથી કોઈપણ સરકારી બેણું જેવું કે, પગાર, રજાપગાર, અધ્યાં, લીવિલ પેશગીઓ, લોન, ઘરભાડાં અંગે થયેલ અધિક ચુકવણીઓ સામે બાકી રહેની રકમ, પગારથોરણની સુધારણા કરતાં થયેલ અધિક ચુકવણી અથવા અન્ય સરકારી બેણું બાકી જણાય તો તે મારા પેન્શન/ મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેન્યુઈટી/ કોમ્પ્યુટર વેલ્યુ ઓફ પેન્શન/પેન્શન પરના કામચલાઉ વધારમાંથી ભરપાઈ કરવા બાંહેથરી/સંમતિ આપું છું.
નિવૃત્તિ બાદ સરકારી રહેણાંક ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે તો વસૂલ કરવા પાત્ર થતું મકાનભાડું મને મંજૂર કરવામાં આવેલ પેન્શન/કુટુંબ પેન્શન અને તે પર મળવાપાત્ર ટી.આઈ.માંથી નિજોરી કક્ષાએ વસૂલાત કરવા બાંહેથરી તેમજ સંમતી આપું છું.પેન્શનની મંજૂર કરેલ રકમમાં ભવિષ્યમાં કોઈ ધરાડો થતા ઉપસ્થિત થતી વસૂલાત પેન્શન, ગ્રેન્યુઈટી, સીવીપી તેમજ કુટુંબ પેન્શનમાંથી વધુ ચુકવણાની વસૂલાત કરવા હું સંમતિ આપું છું.

સ્થળ :

ક્રમચારીની સહી :

તારીખ :

નામ :

હોદ્દો :

કચેરીના વડાની સહી :

નામ :

હોદ્દો :

પેન્થન કેસ

ભાગ-૨

ના. વિભાગના તા.: ૨૪-૦૮-૨૦૨૨ ના ઠરાવ ક્રમાંક: નફન/૧૦૨૦૨૧/૬૮૯૪/પી (પેન્થન સેલ) ના ઠરાવ મુજબ અશક્ત નિવૃત થયેલ કર્મચારીના કચેરીના વડા
/ખાતાના વડાએ પેન્થન અને પ્રોવિડન્ટ ફુડ નિયામકશીને પૂરી પાડવાની રિગતો

૧. પગાર ચકાસણી એકમ ગાંધીનગર દ્વારા અપાયેલ

6th / 7th Pay Sticker નો Pay Verification :

Approval Number / Case Number

૨. સરકારી કર્મચારીનું નામ : અટક નામ પિતા/પતિનું નામ
ગુજરાતીમાં →

અંગ્રેજીમાં (in block letters)	Surname																		
	First Name																		
	Second Name																		

(સેવાપોષણીમાં નોંધા પ્રમાણે, જો સુધારેલ હોય તો એટનો આધાર રાખવો)

૩. હોદ્દો : ગુજરાતીમાં → :

અંગ્રેજીમાં (in block letters) → :

૪. જન્મતારીખ આંકડામાં :

--	--	--	--

૫. નોકરીમાં દાખલ તારીખ :

--	--	--	--

૬. અશક્તતા નિવૃત્તિ તારીખ :

--	--	--	--

૭. પેન્થનનો પ્રકાર : અશક્તતા પેન્થન (નાણા વિભાગના તા. ૨૪/૦૮/૨૦૨૨ના ઠરાવ અન્યથે)

કચેરીનું સીલ

કચેરીના વડાની સહી

નાણા વિભાગના તા. ૨૧.૧૦.૨૦૨૨ના ઠરાવ ક્રમાંક : નપન/૧૦૨૦૨૧/૬૮૧૪/પી(પેન્શન સેલ) સાથેનું બિડાય

c. નિવૃત્તિ બાદ કર્મચારીનું પત્રવ્યવહારનું
સરનામું

૮.(૧) કર્મચારીને PRAN . નંબર _____

(2) કર્મચારીને PPAN નંબર :

(3) NPS મુજબ મળવાપાત્ર નાગ્રંધીય લાભોનું આખરીકરણ થયેલ છે ? (હા / ના)

(अ) जो हा होय तो सरकारी क्षणानी वसुलातनी रकम 3.....

१०. Other state pensioner એટા કે કેમ? (આ/ના)
 આ

੧੧. ਕਾਂਚੇਰੀਨ ਨਾਮ ਸਰਨਾਮਾਂ ਅਤੇ ਕੋਈ ਨਾਮ

(पीनकोड नंबर साथे)

ਕੇਂਦਰੀ ਨਿਵਾਰਣ / ਈ ਮੋਡਲ

(અંગેજ અને શજાતીમાં) :

9.2. ଆମରା ସମ୍ପଦ ଏବଂ ଆମରା କିମ୍ବା ଆମରା କିମ୍ବା

Digitized by srujanika@gmail.com

१३ विभागीय नाम

.....
.....

१२ श्रीमद्भागवत (३) अथ अथ वा इति (३) अथ अथ वा इति त्रिपुरारी विजयं विजयं विजयं

(૧૦) રાન્ડર રાન દાન ઉત્તરાય (૧) દળુ સહિતના મનુષ્યાના (૨) સરકારા ઉમદારા સાથ તમના પાત/પલના સાથ પાસપાટ કદના સુવૃજન ફાટાના પ્રણે નકલ (પાત/પલના ન હોય તો સીગલ ફોટો, કુંદળ પે-નનમાં સીગલ ફોટો, ગાર્ડિયનથીપ હોય તો ગાર્ડિયન સહિતના ફોટો) (૩) ઊંચાઈ અને અંગત ઓળખ ચિનિની વિગત દર્શાવતી બે કાપલીઓ આ સાથે કર્મચારીની અરજી સહિત સામેલ છે.

૧૫.(૧) કુટુંબ પેન્શનને પાત્ર પણી/ પતિ / સંતાન / માતા / પિતાનું નામ :

(નાણા વિભાગના તા. ૨૪/૦૬/૨૦૨૨ના ઠરાવ અન્વયે ગુ. મુ. સેવા (પેન્શન) નિયમો-૨૦૦૨ ના નિયમ-૮૧ (૫), નિયમ - ૮૨ ની શરતો પરિપૂર્ણ થતી હોય તો)

અટક નામ પિતા/પતિનું નામ
ગુજરાતીમાં →
.....
.....

અંગ્રેજીમાં

(in block letters)

Surname								
First Name								
Second Name								

(2) કુપેન્શનરનું અવસાન થતાં પેન્શનપાત્ર અંધ/દિવ્યાંગ/મંદભૂષિય/જા-મથી મક-બધિર સંતાનના નામ :

(નાણા વિભાગના તા.૨૪/૦૮/૨૦૨૨ના હરાવ અન્વયે ગુ.મુ.સે.વા. (પ્રેન્થન) નિયમો -૨૦૦૨નાં નિયમ -૬૩ તેમજ સરકારશીનાં સુધ્યારેલ હરાવો/પરીપત્રો, નિયમોની જોગવાઈની શરતો પરીપૂર્ણ થતી હોય તો)

ગુજરાતીમાં → અટક નામ પિતા/પતિનું નામ

અંગ્રેજુમાં

(in block letters)

Surname								
First Name								
Second Name								

નોંધ: અનુક્રમ નં. ૧૪(૧) અને (૨) માં નામ દર્શાવતાં ચોક્સાઈ કરી લેવી, જેથી ભવિષ્યમાં દાવો યુક્તવામાં મુશ્કેલી ઉપસ્થિત ન થાય.

ਕੁਥੇਰੀਨੂੰ ਸੀਲ

પેન્થન મંજુર કરનાર અધિકારીની સહી

૧૬. અશક્ત થયેલ કર્મચારી પેન્શનનું મૂડીકૃત રૂપાંતર મેળવવા

માંગતા હોય તો માંગણી કર્યાની અરજી તારીખ

મૂડીકૃત રૂપાંતર માટેના ટકા (મહત્તમ ૪૦ ટકા/

ન્યાયિક સેવાના અધિકારી માટે ૫૦ ટકા)

--	--

--	--

--	--	--	--

૧૭. કર્મચારીએ તેમના અવસાન સમયે :

પેન્શન / મુસ્યુ સહ નિવૃતિ ગેજ્યુઈટી / પેન્શન રૂપાંતર ચુકવવા માટે નિયુક્ત કરેલ નોમિનીનું નામ

(નાણા વિભાગના ઠરાવ તા. ૨૩-૦૬-૨૦૦૦ મુજબનું) અટક નામ પિતા / પતિનું નામ

નોંધ : - ૧ અનુક્રમ નં. ૧૭ ના સમર્થનમાં નોમીનેશનની પ્રમાણિત નકલ સામેલ રાખવી.

૧૮. પેન્શનપાત્ર નોકરી ગુમુસેવા (પેન્શન) નિયમ-૨૫)

(એ) એકંદર નોકરી તાં : થી તાં :

દિવસ	માસ	વર્ષ

બાદ : (બી) પેન્શન માટે ન ગણવાનો સમય

(૧) ૩૬ માસથી વધારે અસાધારણ રજા

તાં : થી તાં :

તાં : થી તાં :

(૨) પેન્શનપાત્ર નોકરી તરીકે ન ગણવાના હુકમો થયા

હોય તેવો ફરજ મોક્ષદીનો સમય.

તાં : થી તાં :

તાં : થી તાં :

(૩) ત્રણ માસ કરતાં વધારે મુદ્દની તૂટ હોય ત્યાં

બે ગાળા વર્ષેનો તૂટનો સમય

તાં : થી તાં :

તાં : થી તાં :

(૪) પેન્શનપાત્ર નહીં ગણતી અન્ય મુદ્દાઓ

તાં : થી તાં :

તાં : થી તાં :

પેન્શનપાત્ર નહીં ગણતી નોકરીનો સરવાળો (૧) થી (૪)

(સી) ચોખ્ખી પેન્શનપાત્ર નોકરી (એ – બી)

(ડી) ન્યાયિક સેવાના અધિકારી/મદદારી સરકારી વકીલ માટે

ગુમુસેવા (પેન્શન) નિયમોના નિયમ-૩૭) મુજબ મળવાપાત્ર

નોદિનલ નોકરી કુલ(બી + સી)

(ઇ) પેન્શનપાત્ર નોકરી .(સી + ડી)

નોંધ : પેન્શનપાત્ર નોકરીમાં આપતા સમયમાં પૂરા કરેલ વર્ષ ઉપરાંત જો છ માસ કરતાં ઓછો સમય હોય તો ગણતરીમાં ન લેવો, પરંતુ છ માસ અને તે કરતાં વધુ સમયને પૂરા આપ્યા વર્ષ તરીકે ગણતરીમાં લેવો.

કચેરીનું સીલ

કચેરીના વડાની સહી

૨૦. અશકૃતતા સમયનો છેલ્લો પગાર : રૂ.

૨૧. ખરેખર મેળવેલ પેન્શનપાત્ર પગારની વિગતો : રૂ. ચીતા :

અશકૃતતા સમયનું પગાર ધોરણ :

ક્રમ	માસ	પગાર બેન્ડ/પે ઈન પે મેટ્રીક્ષા- (લેવલ -) પગાર રૂ.	ગ્રેડ પે રૂ.	નોન પ્રોક્ટીસરીંગ એલાઉન્સડ. (જો મળતું હોય તો)	કુલ રૂપીયા
૧					
૨					
૩					
૪					
૫					
૬					
૭					
૮					
૯					
૧૦					
કુલ					
સરવાળો દથ્ય માસ					
માસિક સરેરાશ પેન્શનપાત્ર પગાર					
છેલ્લો પગાર					
ખરેખર પેન્શનપાત્ર પગાર (માસિક સરેરાશ પેન્શનપાત્ર પગાર અથવા છેલ્લો પગાર બેમાંથી જે વધારે હોય તો)					
રૂ.					

છેલ્લાં આર.ઓ.પી.ની ચકાસણી પગાર ચકાસણી એકમ દ્વારા થયેલ છે અનેત્યારપણીના વાર્ષિક ઈજાફા તથા બઢતી વગેરે અન્વયે નિયત કરી ચૂકવવામાં આવેલ પગાર મેં ચકાસણી કરેલ છે અને બરાબર જાણાયેલ છે. તે મુજબ પેન્શનપાત્ર પગાર ગણતરીમાં લીધેલ છે.

નોંધ : (૧) કર્મચારીની અશકૃતતા /ચાલુ નોકરીએ અવસાન પૂર્વે છેલ્લા દસ માસમાં વગર પગારની રજ (LWP) હોય તો તે મુજબ તેમનો વગર પગારની રજ (LWP) ના પૂર્વના સમયનો ચૂકવેલ પગાર દસ માસના હેતુ માટે ધ્યાને લેવો.

(૨) કર્મચારી ફ્રજ મોકૂફી પર હોય અને તે સમયને ફ્રજ મોકૂફી તરફિ જ ગણેલ હોય તો જો કર્મચારી ફ્રજ મોકૂફી પર જતાં પહેલાં મેળવેલ પગાર દસ માસના હેતુ માટે ધ્યાને લેવો.

(૩) કર્મચારી અર્ધપગારી રજ પર હોય તો તે જો રજ પર ગયા ન હોય તો અને ફ્રજ ઉપર હોત અને તે જે પગાર મેળવવા પાત્ર હોય તે પગાર દસ માસના હેતુ માટે ધ્યાને લેવો.

કચેરીનું સીલ

કચેરીના વડાની સહી

૨૨. પેન્થનની ગણતરી : (ગુમુસેવા (પેન્થન) નિયમોના નિયમ-૮૦)

(૧) છુટુંબ પગાર પંચ મુજબ

પેન્થનપાત્ર પગાર= પેન્થન

૨

(૨) સાતમાં પગારપંચ મુજબ

પેન્થનપાત્ર પગાર= પેન્થન

૨

૨૩. કુટુંબ પેન્થન નાણા વિભાગના તા. ૨૪/૦૮/૨૦૨૨ના ઠરાવ અન્વયે ગુમુસેવા (પેન્થન) નિયમોના નિયમ - ૮૦ (૧) (૨)

અશક્તતા નિવૃત્તિ

(એ) કુટુંબ પેન્થન - ૧

અવસાનની તારીખ પછીની તારીખથી સાત વર્ષ સુધી અથવા કર્મચારી જીવતા હોત અને ૬૫ વર્ષની ઉંમરે પહોંચે તાં સુધી આ બે પૈકી જે વહેલું હોય તાં સુધી નીચે મુજબ કુટુંબ પેન્થન મળવાપાત્ર બનશે.

- કર્મચારીને મંજૂર થયેલ પેન્થન જેટલી રકમ રૂ!

(નોંધ : કોઈપણ સંજોગોમાં પગાર બેન્ડમાં પગાર વત્તા ગ્રેડ પે ના સરવાળે આવતી રકમના અથવા પે ઈન પે મેટ્રીક્શના ૩૦% કરતાં ઓછી નહીં તેટલી રકમ હોવી જોઈએ.)

પગાર બેન્ડમાં પગાર વત્તા ગ્રેડ પે ના સરવાળે આવતી રકમ અથવા પે ઈન પે મેટ્રીક્શની રકમ $\times 30\% =$ રૂ!

(બી) કુટુંબ પેન્થન - ૨

ઉપર (૧) (એ) માં દર્શાવેલ સમયગાળા બાદ મળવાપાત્ર કુટુંબપેન્થન

પગાર બેન્ડમાં પગાર વત્તા ગ્રેડ પે ના સરવાળે આવતી રકમના અથવા પે ઈન પે મેટ્રીક્શના ૩૦% જેટલી રકમ રૂ!

પગાર બેન્ડમાં પગાર વત્તા ગ્રેડ પે ના સરવાળે આવતી રકમ અથવા પે ઈન પે મેટ્રીક્શની રકમ $\times 30\% =$ રૂ!

કુચેરીનું સીલ

કુચેરીના વડાની સહી



૨૪. મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુર્ડી :

મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુર્ડી (ગુમુસેવા (પેન્શન) નિયમોના નિયમ- ૮૧) (૧) (૩)

અશક્તતા નિવૃત્તિ સમયે

ઇથી પગારપંચ મુજબ તા. ૦૧-૦૧-૨૦૦૬ થી (મહત્તમ રૂ. ૧૦ લાખ)

$$(પગાર બેન્ડમાં પગાર વત્તા ગ્રેડ પે ના સરવાળે આવતી રકમ + મોંધવારી) \times પેન્શનપાત્ર નોકરી વર્ષ (મહત્તમ રૂ. ૩૩ વર્ષ) = \\ \frac{(\dots\dots\dots\dots\dots + \dots\dots\dots\dots\dots) \times \dots\dots\dots\dots\dots}{2} =$$

સાતમા પગારપંચ મુજબ તા. ૦૧-૦૧-૨૦૧૬ થી (મહત્તમ રૂ. ૨૦ લાખ)

$$(પે ઈન પે મેટ્રીક્ષસ - (લેવલ -) + મોંધવારી) \times પેન્શનપાત્ર નોકરી વર્ષ (મહત્તમ રૂ. ૩૩ વર્ષ) = \\ \frac{(\dots\dots\dots\dots\dots + \dots\dots\dots\dots\dots) \times \dots\dots\dots\dots\dots}{2} =$$

કચેરીનું સીલ

કચેરીના વડાની સહી

નાણા વિભાગના તા. ૨૧.૧૦.૨૦૨૨ના ઠરાવ ક્રમાંક : નફન/૧૦૨૦૨૧/૬૮૯૪/પી(પેન્શન સેલ) સાથેનું બિડાલ

૨૫. પેન્શનની રકમનું મૂડીકૃત રૂપાંતર : ગુમુસેવા (પેન્શન) નિયમોના નિયમ - ૧૦૦)

પેન્શનના મૂડીકૃત રૂપાંતર માટે નિવૃત્તિ પછીની ઉમરના આધારે એક રૂપિયાની રૂપાંતર કરેલ રકમ માટે મૂડીકૃત રકમ:

પછીની જન્મ તારીખે ઉમર	રૂ	પછીની જન્મ તારીખે ઉમર	રૂ	પછીની જન્મ તારીખે ઉમર	રૂ
૨૦	૮.૧૮૮	૪૧	૮.૦૭૫	૬૨	૮.૦૮૩
૨૧	૮.૧૮૭	૪૨	૮.૦૪૮	૬૩	૭.૮૮૨
૨૨	૮.૧૮૬	૪૩	૮.૦૪૦	૬૪	૭.૮૬૨
૨૩	૮.૧૮૫	૪૪	૮.૦૧૮	૬૫	૭.૯૩૧
૨૪	૮.૧૮૪	૪૫	૮.૮૮૬	૬૬	૭.૮૮૧
૨૫	૮.૧૮૩	૪૬	૮.૬૭૧	૬૭	૭.૪૩૧
૨૬	૮.૧૮૨	૪૭	૮.૬૪૩	૬૮	૭.૨૬૨
૨૭	૮.૧૮૦	૪૮	૮.૬૯૩	૬૯	૭.૦૮૩
૨૮	૮.૧૭૮	૪૯	૮.૮૮૧	૭૦	૬.૮૮૭
૨૯	૮.૧૭૬	૫૦	૮.૮૪૬	૭૧	૬.૯૦૩
૩૦	૮.૧૭૩	૫૧	૮.૮૦૮	૭૨	૬.૫૦૨
૩૧	૮.૧૬૮	૫૨	૮.૭૬૮	૭૩	૬.૨૮૬
૩૨	૮.૧૬૪	૫૩	૮.૭૨૪	૭૪	૬.૦૮૫
૩૩	૮.૧૫૮	૫૪	૮.૬૭૮	૭૫	૫.૮૭૨
૩૪	૮.૧૫૨	૫૫	૮.૬૨૭	૭૬	૫.૬૫૭
૩૫	૮.૧૪૫	૫૬	૮.૫૭૨	૭૭	૫.૪૪૩
૩૬	૮.૧૩૬	૫૭	૮.૫૧૨	૭૮	૫.૨૨૮
૩૭	૮.૧૨૬	૫૮	૮.૪૪૬	૭૯	૫.૦૯૮
૩૮	૮.૧૧૬	૫૯	૮.૩૯૯	૮૦	૪.૮૧૨
૩૯	૮.૧૦૩	૬૦	૮.૨૮૭	૮૧	૪.૬૭૧
૪૦	૮.૦૮૦	૬૧	૮.૧૮૪		

રૂપાંતર પેન્શનનો ભાગ X રૂપાંતર રૂ X ૧૨ = રૂ!

..... X X ૧૨ = રૂ!

કચેરીનું સીલ

કચેરીના વડાની સહી

નાણા વિભાગના તા. ૨૧.૧૦.૨૦૨૨ના કરવાની હોય તો તેની વિગત

૨૬. નિવૃત્તિ લાભોમાંથી કપાત કરવાની હોય તો તેની વિગત

(૧) પેન્શનમાંથી કપાત રૂ. રૂ. થી રૂ. સુધી
રૂ. રૂ. થી કાયમી કપાત

પેન્શનમાં કપાત કરવાના શિક્ષાના હુકમ નં.

તા. પેન્શન કાપના શિક્ષાના હુકમ ની નકલ આ સાથે સામેલ છે.

(૨) સરકારી કર્મચારી પાસેથી લેણી રહેણી વિગતો નીચે મુજબ છે. ગુમુસેવા(પેન્શન) નિયમોના નિયમ ૧૩૩/૧૩૪/૧૩૫એ/૧૩૫

ક્રમ	વિગત	ખાતા નંબર	મુદ્દુ	વાર્ષ	કુલ	જમા કરવાનું અંદરાપત્ર સંદર
૧.	મકાન પેશગી					
૨.	વાહન પેશગી					
૩.	પગારલથથાંની વસૂલાત					
૪.	NPS સરકારી ક્ષણાની વસૂલાત					
૫.	અન્ય વસૂલાત					
કુલ વસૂલાત						
અકે રૂપીયા						

ઉપર જણાવેલ વિગતે રહેણાં પેટે પેન્શન/મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુલ્ટી/સેવા ગ્રેજ્યુલ્ટી/મૂડીકૃત રૂપાંતરની રહેણ તેમજ પેન્શન પરના કામચલાઉ વધારામાંથી વસૂલાત કરી જમા કરવા વિનંતી છે.

: પ્રમાણપત્રો:

૨૭. આથી સમગ્રપણે ખાત્રી કરી પ્રમાણિત કરવામાં આવે છે કે, આજની તારીખેશ્વી/શ્રીમતી/કુમારી
..... પાસે કોઈ પણ પ્રકારનું સરકારી લેણું બાકી નથી.

તારીખ :

કાર્યાલાયના વડાની સહી પેન્શન મંજુર કરનાર અધિકારીની સહી

કાર્યાલાયનું સીલ નામ :

હોદ્દો :

૨૮. ખાતાકીય તપાસ પ્રમાણપત્ર : ગુમુસેવા (પેન્શન) નિયમોના નિયમ - ૧૩૮)

આથી સમગ્રપણે ખાત્રી કરી પ્રમાણિત કરવામાં આવે છે કે, શ્રી/શ્રીમતિ/કુન્ઝ... ની સામે આજની તારીખે કોઈ
ખાતાકીય તપાસ ચાલુ/પડતર કે સુચિત નથી.

તારીખ :

સક્ષમ અધિકારીની સહી

નામ :

હોદ્દો :

૨૬. પેન્શનપાત્ર નોકરી અંગેનું પ્રમાણપત્ર : ગુમુસેવા (પેન્શન) નિયમોના નિયમ - ૧૩૧)

આથી પ્રમાણપૂર્વીકૃત કરવામાં આવે છે કે શ્રી તા : ના રોજા

અશક્તના નિવૃત થયેલ છે. તેમની સેવાપોથીની ચકાસણી કરતાં તેમની સમગ્ર નોકરી દરમયાનની ત્રણ માસથી વધુ સમયની કોઈપણ જાતની સેવાતૂટ બાદ કરવાની રહી જતી નથી તેમજ ફરજ મોક્ષદીનો પેન્શનપાત્ર ન ગણેલ સમય બાદ કરવાનો રહી જતો નથી. તેમજ તેમની ઉદ્ માસ કરતાં વધુ સમયની અસાધારણ રજ બાદ કરવાની રહી જતી નથી. તેમજ સમગ્ર નોકરી દરમયાનનો તેમની રજાનો હિસાબ પૂર્ણ કરેલ છે અને છેલ્લા બે વર્ષની સેવાની ચકાસણી કરી સેવાપોથીમાં પ્રમાણપત્ર આપેલ છે.

તારીખ :

સક્રમ અધિકારીની સહી

નામ :

હોદ્દો :

૩૦. ગુમુસેવા (પેન્શન) નિયમો-૨૦૦૨ ના નિયમ-૮(૬૦) અન્વયે મળેલ સત્તાની ઊંઘેથી શ્રી/શ્રીમતી/કુમારી

હોદ્દો ને પેન્શન મંજૂર કરે છું.

સ્થળ:

તારીખ :

ક્યેરીના વડાની સહી

પેન્શન મંજૂર કરનાર અધિકારીની સહી:

ક્યેરીનું સીધ

નામ :

હોદ્દો :

પેન્થનરની ઓળખની નિશાની /ઉંચાઈ / સહીના નમૂના અને ફોટો


(ગુજરાત મુલ્કી સેવા (પેન્થન) નિયમો, ૨૦૦૨ ના નિયમો-૧૩૬,૧૩૭ અને ૧૩૮ તથા ફેર્મ-૨૧)

કલર ફોટો સાઈઝ ૪.૫ સે.મી. X ૩.૫ સે.મી. સાઈઝનો ફોટો જેનું બેકગ્રાઉન્ડ સફેદ હોવું જોઈએ.


શ્રી હોદ્દો

કચેરી / ખાતું / વિભાગ નિવૃત્તિની તારીખ

ઓળખની અંગત નિશાની ઉંચાઈ સહીનો નમૂનો



+ પેન્થનરનો સંયુક્ત ફોટો વાલીનો ફોટો *



+ કુટુંબ પેન્થનરનાં ડિસ્સા સિવાય સંયુક્ત ફોટો સામેલ રાખવો

* જો પેન્થનર સગીર કે, માનસિક દિવ્યાંગ હોય તો જ વાલીનો ફોટો ચોટાડવાનો રહેયો

કચેરીના વડાની સહી


તારીખ :

પ્રમાણિત કરનાર કચેરીના વડાની સહી

નામ :

હોદ્દો :

આ પૃષ્ઠ પર કોઈ લખાણ કરવું નહીં




પેન્શનરની ઓળખની નિશાની / ઊંચાઈ / સહીના નમૂના અને ફોટો

(ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમો-૧૩૬, ૧૩૭ અને ૧૩૮ તથા ફોર્મ-૨૧)


કલર ફોટો સાઈઝ ૪.૫ સે.મી. X ૩.૫ સે.મી. સાઈઝનો ફોટો જેનું બેકગ્રાઉન્ડ સ્ક્રેન હોવું જોઈએ.

શ્રી હોદ્દો
કચેરી / ખાતું / વિભાગ નિવૃત્તિની તારીખ

ઓળખની અંગત નિશાની ઊંચાઈ સહીનો નમૂનો



+ પેન્શનરનો સંયુક્ત ફોટો વાલીનો ફોટો *



+ કુંભ પેન્શનરનાં કિર્સા સિવાય સંયુક્ત ફોટો સામેલ રાખવો

* જો પેન્શનર સર્જીર કે, માનસિક દિવ્યાંગ હોય તો જ વાલીનો ફોટો ચોટાડવાનો રહેશે

કચેરીના વડાની સહી


તારીખ :

પ્રમાણિત કરનાર કચેરીના વડાની સહી

નામ :

હોદ્દો :

આ પૃષ્ઠ પર કોઈ લખાણ કરવું નહીં.



પેન્શનરની ઓળખની નિશાની / ઊંચાઈ / સહીના નમૂના અને ફોટો


(ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમો-૧૩૬, ૧૩૭ અને ૧૩૮ તથા ફોર્મ-૨૧)

કલર ફોટો સાઈઝ ૪.૫ સે.મી. X ૩.૧ સે.મી. સાઈઝનો ફોટો જેનું બેકગ્રાઉન્ડ સફેદ હોવું જોઈએ.



શ્રી હોદ્દો

કચેરી / ખાતું / વિભાગ નિવૃત્તિની તારીખ

ઓળખની અંગત નિશાની ઊંચાઈ સહીના નમૂનો



+ પેન્શનરનો સંયુક્ત ફોટો વાલીનો ફોટો *



+ કુંભ પેન્શનરનાં કિસ્સા સિવાય સંયુક્ત ફોટો સામેલ રાખવો

* જો પેન્શનર સગીર કે, માનસિક દિવ્યાંગ હોય તો જ વાલીનો ફોટો ચોટપદવાનો રહેશે

કચેરીના વડાની સહી


તારીખ :

પ્રમાણિત કરનાર કચેરીના વડાની સહી

નામ :

હોદ્દો :

આ પૃષ્ઠ પર કોઈ લખાણ કરવું નહીં



પેન્શન કેસ - ભાગ-૩

કુટુંબ પેન્શન માટેની અરજી

નાણા વિભાગના તા. ૨૪/૦૮/૨૦૨૨ના ઠરાવ અન્વયે
(સરકારી કર્મચારી નોકરી દરમાન અવસાન પામે ત્યારે ઉપયોગમાં લેવાનું ફોર્મ)

પ્રતિ,

(કચેરી/ખાતા/વિભાગના વડા)

..... ની કચેરી / વિભાગમાં (હોદ્દો) તરફિ ફરજ બજાવતાં મારા
પતિ/પત્ની સ્વ. શ્રી/શ્રીમતી નું તા. ના રોજ અવસાન થયેલ છે તે અન્વયે કુટુંબ
પેન્શન/મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઝિટી માટેની અરજી નીચે વિગતે રજૂ કરું છું.

(ઉક્ત મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઝિટીના હિસ્સા માટે અરજી હોય તો લાગુ પડતા કંલમ ભરવા)

(૧) અરજદારનું નામ :

(Applicant Name) : (in block letters)

(૨) અરજદારની જન્મ તારીખ :

(૩) અરજદારનું સરનામું :

(૪) અવસાન પામેલ કર્મચારી સાથે સંબંધ :

(૫) અવસાનની તારીખે સ્વ. ના કુટુંબના સભ્યોની વિગત(નાણા વિભાગના તા. ૨૪/૦૮/૨૦૨૨ના
ઠરાવ અન્વયે ગુમુસેવા (પેન્શન) નિયમો-૨૦૦૨ ના નિયમ-૮૮ મુજબ વિગતો દર્શાવવી).

ક્રમ	સભ્યનું નામ	જન્મ તારીખ	પરાણિ/અપરાણિ	કર્મચારી સાથેનો સંબંધ	વિશેષ નોંધ
૧.					
૨.					
૩.					
૪.					

ઉપર દર્શાવેલ સભ્યો પેકી ક્રમાંક : ઉપર દર્શાવેલ શ્રી / કુમારી એ સ્વ.
..... ના પુત્ર/પુત્રી અધ્ય/દિવ્યાગ/મંદ ભૂષિદ્ય / જન્મથી જ મૂક-બાધિર છે અને જીવન નિર્વાહ પૂર્ણ કર્મચારી
માટે અશક્તિમાન છે અને આ મતલબનું સીવીલ સર્જનનું મેરીકલ પ્રમાણપત્ર આ સાથે સામેલ છે. પ્રસંગ ઉપસ્થિત થયે તેમના વાલી તરફિ શ્રી
..... ને વાલી તરફિ ફરજ બજાવવા નીમું છું. (નાણા વિભાગના તા. ૨૪/૦૮/૨૦૨૨ના ઠરાવ અન્વયે
ગુમુસેવા (પેન્શન) નિયમો-૨૦૦૨ ના નિયમ-૮૮ મુજબ વિગતો દર્શાવવી)

(૬). મારું કુટુંબ પેન્શન/ મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઝિટી મને નિયમાં નિયુક્તિ ફોર્મ ભરેલ ન હોય/દાખલમાં પ્રાપ્ત ન
હોય તો સર્વર્ગસ્થ કર્મચારીનું સક્ષમ અવિકારી દ્વારા અપાયેલ વારસાઈ પ્રમાણપત્ર સામેલ રાખવું. વધુમાં કુટુંબના જે સભ્યને પેન્શન તેમજ પેન્શનને લગતા નાણાકીય
લાભો મેળવવાના હોય તેની તરફેણું કુટુંબના અન્ય સભ્યોએ નાણાકીય લાભો આપવા બાબતે સંમતિપત્રક રજી કરવું.

અરજદારની સહી

કચેરીનું સીલ

કચેરીના વડાની સહી

પેન્શન મંજુર કરનાર અધિકારીની સહી



(૭) પારસ નિયુક્તિ :-

મારા અવસાનના તુરણ પહેલાના સમયની ચડન કુટુંબ પેન્શનની બાકી રકમ, મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુર્ટી અન્ય કોઈ રીવીજન વાલની ચુકવણી માટે નીચે જણાવેલ વ્યક્તિ (અવસાન પામેલ કર્મચારીના કુટુંબના સભ્ય) ને નિયુક્ત કરું છું.

૧. નિયુક્તનું નામ :
 (in English) :
 સરનામું :

જન્મ તારીખ :

--	--	--	--	--

૨. પેન્શનર સાથે સંબંધ :

૩. જો નિયુક્ત સગીર હોય તો સગીર વય દરમાન
જેને વાલી નિયુક્ત કરેલ હોય તેનું નામ સરનામું

૪. જો આસન-૧ માં જણાવેલ નિયુક્તનું કુટુંબ પેન્શનર
પહેલાં અવસાન થાય તેવા પ્રસંગે અન્ય નિયુક્તનું :

નામ, સરનામું, જન્મતારીખ, કુટુંબ પેન્શનર સાથે સંબંધ :

૫. જો અન્ય નિયુક્ત સગીર હોય તો સગીર વય દરમાન
જેને વાલી નિયુક્ત કરેલ હોય તેનું નામ સરનામું :

૬. આથી હું શ્રી/શ્રીમતી/કુમારી બાંહેધરી ખત આપું છું કે મારા
પતિ/પત્ની/ પિતામાતા સ્વ. શ્રી/શ્રીમતી ના તા. :

ના રોજ થયેલ અવસાન પહેલાનું કોઈપણ સરકારી લોણું જેવું કે, પગાર, રજાપગાર, ભથ્થાં, લીધિલ પેશગીઓ, લોન, ધરભાડા અંગે થયેલ અધિક
ચુકવણીઓ સામે બાકી રહેતી રકમ, પગારથોરણની સુધારણા કરતાં થયેલ અધિક ચુકવણી અથવા અન્ય સરકારી લોણું બાકી જણાય તો તે મારા કુટુંબ
પેન્શન/મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુર્ટીમાંથી ભરપાઈ કરવા બાંહેધરી/સંમતિ આપું છું. સ્વ. શ્રી/શ્રીમતી

..... ના અવસાન બાટ સરકારી રહેણુંક ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે
તો વસૂલ કરવા પાત્ર થતું મકાનભાડું મને મંજૂર કરવામાં આવેલ કુટુંબ પેન્શન અને તે પર મળવાપાત્ર ટી.આઈ.માંથી નિજોરી કષાએ વસૂલાન કરવા
બાંહેધરી નેમજ સંમતી આપું છું. ગુમુસેવા(પેન્શન) નિયમોના નિયમ ૧૩૪/૧૩૪-એ/૧૩૫)

૭. આથી હું જાહેર કરું છું કે માંગણી કરવામાં આવેલ ગ્રેજ્યુર્ટી માટે પાત્ર બનાવતી નોકરીના કોઈ ભાગ માટે અરજી કરી નથી તેમજ હવે પછી અરજી કરીશ
નહીં.

૮. અરજદારની સહી અથવા ડાબા હાથના અંગૂધાની શાપ :

તારીખ :

શાખ કરી :

અરજદાર રહેતા હોય તે ગામ/નગર અથવા પરંગાણની બે કે તેથી વધુ પ્રતિક્રિયા અનુભૂતિ શાખ કરવી.

ક્રમ નામ

સરનામું

સહી

(૧)

(૨)

સ્થળ :

અરજદારની સહી

તારીખ :

કચેરીના વડાની સહી

પેન્શન કેસ - ભાગ-૪

નાણા વિભાગના તા. ૨૪/૦૮/૨૦૨૨ના ઠરાવ અન્વયે
કર્મચારીનું ચાલુ નોકરીએ અવસાન થાય તારે કચેરીના વડાએ મંજૂર કરેલ કુટુંબ પેન્શન

૧. કર્મચારીનું નામ	:									
(in English)	:									
૨. કર્મચારીનો ડોદો	:									
૩. જન્મ તારીખ	<table border="1"><tr><td></td><td></td></tr><tr><td></td><td></td></tr><tr><td></td><td></td></tr></table>									
૪. નિમાલૂંક તારીખ	<table border="1"><tr><td></td><td></td></tr><tr><td></td><td></td></tr><tr><td></td><td></td></tr></table>									
૫. અવસાન તારીખ	<table border="1"><tr><td></td><td></td><td></td></tr><tr><td></td><td></td><td></td></tr><tr><td></td><td></td><td></td></tr></table>									



(અવસાન દાખલાની પ્રમાણિત નકલ સામેલ રાખવી)

૬. સરકારી કર્મચારીની પેન્શનપાત્ર નોકરી	: <table border="1"><tr><td></td><td></td></tr><tr><td></td><td></td></tr></table>				
બાદ: પેન્શન માટે ન ગણવાનો સમય	: <table border="1"><tr><td></td><td></td></tr><tr><td></td><td></td></tr></table>				
કુલ ચોખ્ખી પેન્શનપાત્ર નોકરી	: <table border="1"><tr><td></td><td></td></tr><tr><td></td><td></td></tr></table>				
૭. સરકારી કર્મચારીનું અવસાન સમયનું પગાર બેન્ડ	:				
અથવા એ ઈન પે મેટ્રીલ લેવલ - :	:				
૮. સરકારી કર્મચારીનો છેલ્લો પગાર બેન્ડમાં પગાર વત્તા	:				
ગેડ પે ના સરવાળે આવતી રૂમ	:				
અથવા . પે ઈન પે મેટ્રીલ લેવલ - :	:				
૯. (૧) કર્મચારીનો PRAN નંબર :					
(૨) કર્મચારીનો PPAN નંબર :					
(૩) NPS મુજબ મળવાપાત્ર નાણાંકીય લાભોનું આખરીકરણ થયેલ છે ? (હા / ના)					
(અ) જો હા હોય તો સરકારી ફાળાની વસૂલાતની રૂમ ૩.....					
૧૦. સ્વ. શ્રી/શ્રીમતી ને કુટુંબ પેન્શન જિલ્લા તિજોરી/પેટા તિજોરી					
..... માર્ગે પેન્શન ચૂકવણી કરવાની છે.					
૧૧. સ્વ. શ્રી/શ્રીમતી ની અવસાન તારીખે કોઈ સરકારી લોણું બાકીમાં નથી.					
૧૨. સ્વ. શ્રી/શ્રીમતી અવસાનની તારીખે કોઈ ખાતાકીય તપાસ સૂચિત કે બાકી ન હની/સૂચિત કે					
બાકી તપાસ પડતી મૂકવામાં આવી છે. (હુકમની નકલ સામેન છે.)					
૧૨. (૧) સ્વ. ના કુટુંબની વિગતો ચકાસણી કરી પ્રમાણિત કરવામાં આવેલ છે અને તેમના					
પત્ની/પતિ/પુત્ર/પુત્રી શ્રી/શ્રીમતી/કુમારી ને કુટુંબ પેન્શન/ગ્રેજ્યુરી મંજૂર કરું છું.					
અથવા					
સ્વ. અવસાનની તારીખ કુટુંબ ધરાવતા ન હતા. તેમના પર આધારીત માત્રા/પિતા					
શ્રી/શ્રીમતી ને કુટુંબ પેન્શન મંજૂર કરું છું.					
(૨) કુટુંબ પેન્શનની જન્મ તારીખ :					
૧૩. સ્વ. શ્રી / શ્રીમતી..... ના અંધ/દિવ્યાંગ/મંદબુધિ/જન્મથી જ મૂક-બાધિર પુત્ર/પુત્રી શ્રી/કુમારી					
..... ને આજીવન કુટુંબ પેન્શન મંજૂર કરું છું. (નાણા વિભાગના તા. ૨૪/૦૮/૨૦૨૨ના ઠરાવ અન્વયે					
GCSR(પેન્શન) -૨૦૦૨નાં નિ-૮૮મુજબ વિગતો દર્શાવવી).					

અથવા

સર્વોસ્થની અવસાન તારીખે નીચે મુજબનું સરકારી લોણું બાકી છે, જે મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુરીમાંથી વસૂલ લેવાનું છે. :-

ક્રમ	વિગત	ખાતા નંબર	મુદ્દ્દા	વ્યાજ	કુલ	જમા કરાવવાનું અંદાજપત્ર સંદર
૧	મકાન પેશગી					
૨	વાહન પેશગી					
૩	પગારભથ્થાતી વસૂલાત					
૪	NPS સરકારી ફાળાની વસૂલાત					
૫	અન્ય વસૂલાત					
કુલ વસૂલાત						
અંગે રૂપીયા						

** સરકારી લેણાંની માંડવાળના કિસ્સામાં હુકમની નકલ સામેલ રાખવી

કર્યોરીનું સીલ

કર્યોરીના વડાની સહી

પેન્શન મંજૂર કરનાર અધિકારીની સહી

૧૪. સ્વ. એ તેમની હ્યાની દરમાન કરેલ નિયુક્તિ અનુસાર
શ્રી ને મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુર્ટી ચૂકવવાની છે.
૧૫. સ્વ. એ નિયુક્તિ કરેલ ન હોઈ, અવસાનની તારીખે કર્મચારીની ગ્રેજ્યુર્ટી
મેળવવાને પાત્ર હોય, તેવા કુટુંબના સભ્યોની વિગત.
(અ) વિધવા પત્ની/પતિ, અપરાધિન પુત્ર/પુત્રી, વિધવા પુત્રીઓ
1.
2.
3.
4.
5.
(બી) પિતા/માતા, અઢાર વર્ષથી નીચેની ઉમરના ભાઈઓ, અપરાધિન ભાઈઓ, પરાધિન પુત્રીઓ, અગાઉ અવસાન પામેલ
પુત્રના બાળકોને
1.
2.
3.
નિયુક્તિ કરેલ ન હોઈ ઉપર જાણવાયા પ્રમાણે વ્યક્તિઓને સરખે હિસ્સે મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુર્ટીચૂકવવાની રહે છે. તેમની દરેકની અરજી, ફોટોગ્રાફ્સ,
સહીના નમૂના અંગત ઓળખ વર્ગે આ સાથે સામેલ છે.
અથવા
ઉપર જાણવેલ (એ) અથવા (બી) પેકી શ્રી ની તરફે એમાં ચુકવણી કરવા માટે નીચેના
વ્યક્તિઓએ સંમતી આપેલ છે :-
1.
2.
3.
અને તે કચેરીનાં વડાની રૂમે સ્વીકારેલ છે. (સંમતિપત્રો સામેલ છે.)
૧૬. કોલમ-૧૩ પેકી શ્રી સગીર હોઈ તેમની રકમ કાયદેસરના વાલી શ્રી
..... ને ચુકવી આપવાની છે.
(સહી પુત્ર/પુત્રીનો હિસ્સો, કુદરતી વાલી અંટલે કે માતા/પિતાને ચૂકવવાનો છે. અન્ય કિસ્સામાં લોક તો વાલીપણનો દાખલો તેની ઓળખ તથા સરનામાને
લગતી આવશ્યક બાબતો સામેલ રાખવી)
૧૭. આ સાથે નીચેના બિડાણો સામેલ કરું છું.
(૧) પેન્શનરના ત્રણ કાગળ પર ચોટાડેલ પ્રમાણિત કરેલ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ. (૨) ત્રણ સહીના નમૂના રાજ્ય પત્રિત અધિકારી દ્વારા પ્રમાણિત કરેલ.
(૩) ઉચ્ચાઈ ઓળખની બે પ્રમાણિત કાપલી. (૪) અવસાનના દાખલાની પ્રમાણિત નકલ. (૫) ગ્રેજ્યુર્ટી માટે ભરેલ નિયુક્તિની પ્રમાણિત અથવા મૂળ નકલ.
(૬) અન્ય.
૧૮. કુટુંબ પેન્શનની ગણતરી(નાણા વિભાગના તા. ૨૪/૦૮/૨૦૨૨ના ઠરાવ અન્યથે ચાલુ નોકરીમાં અવસાનઃ (નિયમ - ૮૦ (૧) (૧) મુજબ ગણતરી
- (૧) ચાલુ નોકરીમાં અવસાન સમયે કુટુંબ પેન્શનની ગણતરી
(એ) કુટુંબ પેન્શન - ૧
ચાલુ નોકરીમે અવસાન થાય ત્યારે અવસાનની તારીખ પછીની તારીખથી પ્રથમ દસ વર્ષ સુધી નીચે મુજબ કુટુંબ પેન્શન મળવાપાત્ર
થશે.
પગાર બેન્ડમાં પગાર રતા ગ્રેડ પે ના સરવાળે આવતી રકમના અથવા પે ઈન પે મેટ્રીક્ષની રકમના ૫૦% જેટલી રકમ રૂ!
.....
પગાર બેન્ડમાં પગાર રતા ગ્રેડ પે ના સરવાળે આવતી રકમ અથવા પે ઈન પે મેટ્રીક્ષના ૫૦% X ૫૦% = રૂ!
-
- (બી) કુટુંબ પેન્શન - ૨
ન્યારબાદ એટલે કે કર્મચારીના અવસાનની તારીખ પછીની તારીખથી દસ વર્ષે પછી
પગાર બેન્ડમાં પગાર રતા ગ્રેડ પે ના સરવાળે આવતી રકમના અથવા પે ઈન પે મેટ્રીક્ષના ૩૦% જેટલી રકમ રૂ!
.....
પગાર બેન્ડમાં પગાર રતા ગ્રેડ પે ના સરવાળે આવતી રકમ અથવા પે ઈન પે મેટ્રીક્ષના ૩૦% X ૩૦% = રૂ!
-

પેન્શન કેસ - ભાગ-૫

નાણા વિભાગના તા. ૨૪/૦૮/૨૦૨૨ના ઠરાવ અન્વયે

અશક્તતા / ચાલુ નોકરીએ અવસાન થતા બિનસરકારી અનુદાનિત સંસ્થાના કર્મચારીઓ માટે ભરવાનું ફોર્મ

સ્વાના :

ક્રમાંક :

તારીખ:

પ્રતિ,

નિયમકશી, પેન્શન અને પ્રોવિડ-ન્ટ ફૂડ,
વિમા અને લેખા ભવન,
ડૉ. જીવરાજ મહેતા ભવન સંકુલ,
સેક્ટર - ૧૦/બી, ગાંધીનગર

વિષય : બિનસરકારી કર્મચારીઓના પેન્શન પેપર્સ મોકલવા બાબત

શ્રી/શ્રીમતી	:
હોદ્દો	:
શાળા / કોલેજ	:
PRAN નંબર	:
PPAN નંબર	:

માનનીયશ્રી,

જ્યથ ભારત સહ ઉપરોક્ત બાબતે આ સાથે..... શાળા/કોલેજના હોદ્દો
..... શ્રી ના પેન્શન પેપર્સ તથા અસલ સેવાપોથી તૈયાર કરીને નીચેની

વિગતે રજૂ કરવામાં આવે છે, તો નાણા વિભાગના તા. ૨૪-૦૮-૨૦૨૨ ના ઠરાવ ક્રમાંક : નયન/૧૦૨૦૨૧/૬૮૧૪/પી (પેન્શનસેલ) મુજબના
લાભો અધિકૃત કરવા વિનંતી છે.

શ્રી/શ્રીમતી એ.તા. થી.તા.
સુધીની કરેલ નોકરીની તારીઝ નીચે મુજબ છે.

ક્રમ	શાળા/કોલેજમાં નોકરી કરી તેનું નામ	સમયગાળો તારીખથી તારીખ	કુલ નોકરીના વર્ષ માસ દિવસ	પેન્શનપાત્ર નોકરીના વર્ષ માસ દિવસ
.....
.....
.....
.....
કુલ

ઉપર જાણવેલ હકીકત કર્મચારીની સેવાપોથીમાંથી તુરતી ચકાસાળી કરીને લાંબા છે અને તે સાચી છે.

આચાર્ય
નામ સહી અને સિક્કો

પેન્શન મંજૂર કરનાર અધિકારી

(પેન્શન મંજૂર કરનાર અધિકારીનું પૂરું નામ, હોદ્દો અને કચેરીનો સિક્કો)

પ્રમાણપત્રો (પ્રાથમિક/માધ્યમિક શાળા/કોલેજ/યુનિવર્સિટીના કર્મચારીઓ સંબંધિત)

(લાગુ ન પડતા પ્રમાણપત્રો ટૂંકી સહી કરી છેકી નાંખવા)

- શ્રી લાંદો તા. ના રોજ
- અશક્તના નિવૃત્ત થાય છે/યાબુ નોકરીએ મૂલ્ય સામેલ છે. નાંખોની સેવાપોથીની ચકાસણી કરીને નીચે મુજબ પ્રમાણપત્રો આપવામાં આવે છે :-
- (૧) મજૂર કર્મચારીએ તા. થી તા. સુધીની જે નોકરી કરી છે તે બિનસરકારી માન્ય અને અનુદાન મેળવતી સેકન્ડરી શાળાઓની છે.
 - (૨) મજૂર કર્મચારી તા. થી તા. સુધી સરકારી અનુદાનમાંથી પગાર અને ભધાંની ચુકવણી કરવામાં આવી છે.
 - (૩) મજૂર કર્મચારી તા. થી તા. સુધી તેમની નોકરીના ડ્રેક વર્ષ માટે ગ્રાન્ટ-ઇન-એઈડ, સેકન્ડરી ઓફિસેશન રેયુલેશનના નિયમાનુસાર નિયત રેશીયા પ્રમાણેના કર્મચારી તા. તેમજ કોઈપણ વર્ષ વધારના અવેજ, પાર્ટ ટાઈમ કર્મચારી હતા નહીં.
 - (૪) મજૂર કર્મચારીએ તા. થી તા. સુધીની પોતાની સમગ્ર નોકરી દરમાન તાલીમના ગાળા સહિત છત્રીસ માસથી વધારે બિનપગારી (અસાધારણ) રજાઓ જોગવેલ નથી.
 - (૫) મજૂર કર્મચારીને ૨૦% ની મર્યાદામાં સિલેક્શન ગ્રેડના પગારથોરણમાં પગાર નક્કી કરી આપ્યો છે, જે બરાબર છે અને તે અંગેની કોઈ વસ્તુલાન કરવાની થતી નથી.
 - (૬) મજૂર કર્મચારીને ભૂતપૂર્વ શિક્ષણ અને મજૂર વિભાગના તા. ૦૪/૦૬/૧૯૬૪ ના ઠરાવ નં., આઈએનએસ/૧૬૦૧/ગ મુજબ રજિત શિક્ષક તરીકે જહેર કરેલ છે. તેથી તેમની તા. થી તા. સુધીની નોકરી પેન્શનપાત્ર ગણવાની છે. (હુકમની નકલ સામેલ રાખવી)
 - (૭) મજૂર કર્મચારીએ તા. થી તા. સુધી નામની મિડલસ્કૂલમાં નોકરી કરી હતી તે સમયે મિડલ સ્કૂલ નામની માન્ય અને અનુદાન મેળવતી બિનસરકારી માધ્યમિક શાળા સાથે જોડાપેલી હતી.
 - (૮) મજૂર કર્મચારીએ તા. થી તા. સુધીની પોતાની સમગ્ર નોકરી દરમાન જે પગાર ચુકવ્યો તે સરકારશીએ માન્ય કરેલ પગારથોરણમાં ચુકવ્યો છે. તેમજ મજૂરને વાયનો વખત લાગુ પડાપેલ તમામ પગારથોરણ માન્ય રાખવામાં આવેલ છે. વધુમાં આ તમામ પ્રકારના પગાર ધોરણનું ફીક્સેશન કરાવી તેની નોંધો મજૂરની સેવાપોથીમાં કરાવવામાં આવેલી છે અને કોઈ પગારથોરણમાં ફીક્સેશન કરાવવું બાકી નથી.
 - (૯) મજૂર કર્મચારીની તા. થી નિવૃતીની તા. સુધીની સેવાપોથી તથા લીલ એકાઉન્ટની તમામ નોંધો વર્ષવાર સંપૂર્ણ લખવામાં આવેલી છે અને તેમાં હવે વધુ કોઈ નોંધ કરવાની બાકી નથી તેમજ તમામ નોંધો શાળાના રેકર્ડ સાથે સરખાવી ચકાસેલ છે અને બરાબર માલુમ પડેલ છે.
 - (૧૦) આ સાથે નીચેના દસ્તાવેજો સામેલ છે.
 - ૧) પેન્શન યોજના સ્વીકાર્યાનું પ્રમાણિત ઓફશન ફોર્મ.
 - ૨) અવસાનના કેસમાં અવસાનનું પ્રમાણપત્ર
 - ૩) અશક્તના પેન્શન કેસમાં દાકતરી પ્રમાણપત્ર
 - ૪) બ્રેક કન્ડોનના હુકમોની પ્રમાણીત નકલો.

કર્મચારીની સહી - આર્યાની સહી/સંચાલકની સહી
નામ અને સહી સિક્કો

પેન્શન મંજૂર કરનાર અધિકારી/ઉચ્ચ શિક્ષણ કમિશનરની સહી
(પેન્શન મંજૂર કરનાર અધિકારીશ્રીનું પૂરું નામ અને કચેરીનો સિક્કો)

ભાગ- ૧, મુદ્દા નં- ૧૪ની સુચનાઓ

ભાગ- ૧, મુદ્દાનં- ૧૪, કુટુંબ પેન્શન અર્થે શારિરીક- માનસિક વિકલાંગ સંતાનોના નામ દાખલ કરવા નીચે મુજબના સાધનિક કાગળો સામેલ રાખી કેસ રજુ કરશો.

૧. સરકારશ્રીના નાણા વિભાગના ઠરાવ ક્રમાંક નં. નવત-૧૨૮૮-૧૧૬૦-પી, તા.૦૬-૧૦-૧૯૮૮ માં સમાવિષ્ટ પરિશિષ્ટ - ૧ તેમજ પરિશિષ્ટ - ૨ સામેલ રાખી ઠરાવની જોગવાઈઓને અનુસરીને દરખાસ્ત રજુ કરશો.
૨. વિકલાંગતાના તાજેતરના (છેલ્લા ત્રણ વર્ષમાં ઈસ્યુ થયેલ) પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
૩. વિકલાંગ વ્યક્તિની આવકનું પ્રમાણપત્ર (મામલતદાર / T.D.O દ્વારા ઈસ્યુ થયેલ)
૪. શારિરીક વિકલાંગતા ડોય તો વિકલાંગ વ્યક્તિના પાસપોર્ટ સાઈઝના ફોટો, સહિના નમુના, ઓળખની નિશાનીઓ, ઉંચાઈ વગેરે ત્રણ નકલમાં રજુ કરવા તેમજ માનસિક વિકલાંગતાના કિસ્સામાં વિકલાંગ વ્યક્તિ તેમજ વાલી બંનેના પાસપોર્ટ સાઈઝના ફોટો, સહિના નમુના, ઓળખની નિશાનીઓ, ઉંચાઈ વગેરે ત્રણ નકલમાં રજુ કરવા.
(પેન્શન ફોર્મમાં આપેલ નમૂના મુજબ)
૫. જો માનસિક વિકલાંગતા ડોય તો ઉપરોક્ત ઠરાવના પરીશિષ્ટમાં માતા/પિતા સિવાય અન્ય સભ્યની વાલી તરીકે નિમણુંક કરવી.
૬. સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના “ઠરાવ ક્રમાંક-પરચ-૧૧૨૦૧૮/યુ.ઓ.આર.-૪/અ” તા.૨૧-૧૦-૨૦૨૨થી નિયત કરેલ નમુનામાં સક્ષમ અવિકારીશ્રીનું પ્રમાણપત્ર સામેલ રાખવાનું રહેશે.
૭. નાણા વિભાગના તા.૦૬-૧૦-૧૯૮૮ ના ઠરાવ ક્રમાંક : નવત-૧૨૮૮-૧૧૬૦-પી અથવા નાણા વિભાગના તા.૦૫-૦૫-૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક : પરચ-૧૦૨૦૧૩-ઓ-૮૮-પી અન્વયે દરખાસ્ત કરવામાં આવેલ છે તે સ્પષ્ટ જણાવવું.

Annexure I

ચલણ નં.

..... સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયામાં ભરેલ રકમનું ચલણ

નાણાં મોકલનારે ભરવાનું	ખાતાના અમલદારે અથવા ટ્રેઝરી અમલદારે ભરવાનું										
હિસાબનું સદર											
જેના તરફથી નાણાં ભરવામાં આવ્યા હોય તે વ્યક્તિનું નામ અથવા હોદ્દો અને સરનામુ	<table border="1"> <tr> <td>મુખ્ય સદર</td> <td>0071</td> </tr> <tr> <td>પેટા મુખ્ય સદર</td> <td>01</td> </tr> <tr> <td>ગૌણ સદર</td> <td>101</td> </tr> <tr> <td>પેટા સદર</td> <td>01</td> </tr> </table>			મુખ્ય સદર	0071	પેટા મુખ્ય સદર	01	ગૌણ સદર	101	પેટા સદર	01
મુખ્ય સદર	0071										
પેટા મુખ્ય સદર	01										
ગૌણ સદર	101										
પેટા સદર	01										
મોકલેલા ભરણાની પુરેપુરી વિગત અને અંગેના હુકમ (કોઈ હોય તો)	રકમ	બેન્કને હુકમ બરાબર છે. નાણાં લેવા તથા તેની પહોંચ આપવી									
PPAN	રકમ	તારીખ –									
PRAN											
NAME											
અવસાન ના કિસામાં કુટુંબ પેન્શનનો લાભ મેળવવા ક્ષરકારના હિસાની રકમ પરત જમા કરવા અંગે											
અંકે ૩.											
.....											
સહી											
રકમ	પૈસા	મંદ્યા	તારીખ								
ખજાનથી	હિસાબનીશ	તિજોરી અધિકારી/એજન્ટ									

Annexure II

No objection for settlement of Accumulated Pension Wealth in NPS

{To be enclosed along with nodal office declaration where family pension is granted to the claimant(s) of deceased subscriber or to the subscriber (in case of disability)}

I / We (name of the claimant/subscriber), hereby confirm that I/we have no objection for release of NPS accumulated pension wealth lying in PRAN of subscriber Late Sh./Smt/Ms _____ with PRAN _____ or in my PRAN _____ to Nodal Office/Department where I/he/she was employed as I/we am/are receiving the family pension under Pension Payment Order no _____ dated _____

Details of pension being paid (in case of Death):

Name of the Family member _____

Pension Payment Order (PPO) No _____

Signature/Thumb impression of Claimant _____

Relationship with deceased _____

Address: _____

Phone/Mobile Number/E-mail: _____

Place:

Date:

Details of pension being paid (in case of Disability):

Name of the Subscriber _____

Pension Payment Order (PPO) No: _____

Signature/Thumb impression of Subscriber: _____

Address: _____

Phone/Mobile Number/E-mail: _____

Place:

Date:

Attestation by Nodal Office:

It is certified that the above declaration and details have been entered and signed/thumb impressed by the family member(s) of deceased subscriber Sh./Smt/Ms _____ (PRAN) _____ or by the subscriber before me. Further the above details have been verified from the service record of the deceased subscriber/subscriber and found in order. Further,

- I/We hereby declare that No Objection Certificate to transfer the accumulated pension wealth from the NPS account of the deceased subscriber/subscriber to this office have been collected from the family member(s) of the deceased subscriber/subscriber.
- I/We hereby declare that details furnished above are true and correct as per our office records. PFRDA/NPS Trust/CRA shall not be responsible in case of any wrong information furnished in this regard. Further, I understand that funds will be transferred to PAO bank account on authorisation of withdrawal request by office and physical documents required to be forwarded to CRA for record keeping within 60 days of authorization of withdrawal request.
- I/We hereby declare that copy of Death Certificate of the Subscriber (in case of family pension) and copy of PRAN Card/ePRAN of the Subscriber have been collected from the family member(s) of the deceased Subscriber/Subscriber and duly attested by Office.

Stamp & Signature of DDO/DTO/PAO

Date:	Name of the DDO/DTO/PAO
Place:	Regn No: